


# શિવામંદુ-સેવન-૧



શિવામંદુ આયુ પ્રકાશન

આચુ પ્રકાશન - પુસ્તક ફેદું

# શિવાનભુ-સેવન

( ભાગ પછેલા )

શીર્ષોમણ

આચુ પ્રકાશન

૨૧૨-સર્વોદય, ખીલે માળ,  
રિલીઝ સનેમા અને જી.પી.ઓ. વર્ચે  
સલાપસ માર્ગ, અમદાવાદ

\* लेखक

## शोलन

\* © सर्वां हुक स्वाधीन

\* प्रकाशक :

जगहीश वसाणी

‘आयु प्रकाशन’

सर्वोदय, खीले भाग,

रिलीइ सिनेमा पासे,

अमदाबाद-१

ईन : २१२९१

\* प्रथम आवृत्ति :

१-१-'८०

\* कुल प्रत : २१००

\* कि : ३ १०-००

\* मुद्रक :

राजेश के. हेसाई

चंद्रिका प्रिन्टरी,

मिरजापुर रोड,

अमदाबाद-३८० ००१

ईन : २०५७८

જેમણુ  
‘શિવામ્બુ’ના  
સર્વપ્રથમ  
વ્યવસ્થિત ગુળુદોષ  
વિશ્વ સમક્ષ ધર્યા તેવા  
‘શિવામ્બુ-કદ્દપ’ના કર્તા  
અને  
આયુર્વેદના સંહિતાકારો,  
નિધંડુકારો અને ભણવૈઘોને  
સાદર સમપ્રિત...

—શાલન

## વैद्य શોસુનનું આયુર્વેદીય સાહિત્ય

|  |                         |
|--|-------------------------|
| ૧. અતૃપ્તિ જંખના(ખી.આ.) (આયુર્વેદીય નવલકથા)      | ૪૫-૦૦                   |
| ૨. અણુઅણુમાં આયુર્વેદ (આયુર્વેદ સિદ્ધાંત)        | ૩૫-૦૦                   |
| ૩. અનુભવનું અમૃત (ભાગ પહેલો) (ખીજુ આ.)           | ૧૫-૦૦                   |
| ૪. અનુભવનું અમૃત (ભાગ બીજો) (ખીજુ આ.)            | ૨૫-૦૦                   |
| ૫. આપણાં ધૂમજૂનસી ઔષધો (ખીજુ આવૃત્તિ)            | ૮-૦૦                    |
| ૬. આમળાં (ચોથા આવૃત્તિ)                          | ૧૮-૦૦                   |
| ૭. આયુર્વેદ અનિવાર્ય છે (ખીજુ આવૃત્તિ)           | ૫-૦૦                    |
| ૮. આયુર્વેદ-નિનાદ (આયુર્વેદનાં ગીતો)             | ૫-૦૦                    |
| ૯. આયુર્વેદ હવે ધરધરમાં (કિશોરા માટેનું આસ)      | ૪-૫૦                    |
| ૧૦. આયુર્વેદની પુનઃ પ્રતિષ્ઠા (આયુર્વેદીય લેખો)  | ૪-૫૦                    |
| ૧૧. આયુર્વેદીય રોડયો વાતાલાપ (સાત પ્રશ્નોત્તરી)  | ૬-૫૦                    |
| ૧૨. આરોગ્ય અને ઔષધ-૧(ખી.આ.) (લેખસંગ્રહ)          | ૩૦-૦૦                   |
| ૧૩. આરોગ્ય અને ઔષધ-૨                             | (લેખસંગ્રહ) ૨૦-૦૦       |
| ૧૪. આરોગ્ય અને ઔષધ-૩                             | (લેખસંગ્રહ) ૨૫-૦૦       |
| ૧૫. આરોગ્ય અને ઔષધ-૪                             | (લેખસંગ્રહ) ૨૫-૦૦       |
| ૧૬. આરોગ્ય અને ઔષધ-૫                             | (લેખસંગ્રહ) ૩૦-૦૦       |
| ૧૭. આરોગ્ય અને ઔષધ-૬                             | (લેખસંગ્રહ) ૪૦-૦૦       |
| ૧૮. આરોગ્ય આપણા સૌનું-૧                          | (આહાર) ૧૦-૦૦            |
| ૧૯. આરોગ્ય આપણા સૌનું-૨                          | (વિહાર-૧) ૭-૫૦          |
| ૨૦. આરોગ્ય આપણા સૌનું-૩                          | (વિહાર-૨) ૭-૫૦          |
| ૨૧. આરોગ્ય પ્રશ્નોત્તરી-૧ (એકસો એકાવન પ્રશ્નો)   | ૧૦-૦૦                   |
| ૨૨. આરોગ્ય પ્રશ્નોત્તરી-૨ (એકસો પચાસ પ્રશ્નો)    | ૧૨-૦૦                   |
| ૨૩. આરોગ્ય-સૂત્ર (ક્ષેડોનું અને સૂત્રોનો સંગ્રહ) | ૫-૦૦                    |
| ૨૪. છિઠો ! આયુર્વેદને અપનાવો (ખીજુ આવૃત્તિ)      | ૩-૦૦                    |
| ૨૫. કમળો   | (કેસેટ-મેટર સહિત) ૧૦-૦૦ |
| ૨૬. ટાક્ટો                                       | (પોકેટ યુક) ૨-૦૦        |

|     |   |                     |       |
|-----|---|---------------------|-------|
| २७. | કાનતના રોગો                               | (ખીજુ આવૃત્તિ)      | ૧૬-૦૦ |
| ૨૮. | કાનતના રોગો                               | (સંક્ષિપ્ત)         | ૬-૦૦  |
| ૨૯. | ગાંધીજીની આયુર્વેદ-દર્શિ                  | (પોટેટ ખુંક)        | ૩-૫૦  |
| ૩૦. | ધરગથથું તાત્કાલિક સારવાર (ત્રીજુ આવૃત્તિ) | ૮-૦૦                |       |
| ૩૧. | ચામડીના રોગો (ચર્મરાગ વિશે સંપૂર્ણ)       | ૨૦-૦૦               |       |
| ૩૨. | ચામડીના રોગો                              | (સંક્ષિપ્ત)         | ૬-૦૦  |
| ૩૩. | જેર તો પિવાતાં જાણી જાણી ! (ચાર લાગ)      | ૫૨-૦૦               |       |
| ૩૪. | તમે જ તમારા વૈઘ                           | (ત્રીજુ આવૃત્તિ)    | ૫-૦૦  |
| ૩૫. | તુલસી                                     | (ચોથી આવૃત્તિ)      | ૩-૦૦  |
| ૩૬. | ત્રિકુળા                                  | (ત્રીજુ આવૃત્તિ)    | ૨-૫૦  |
| ૩૭. | દ્રાક્ષા                                  | (પરિયય પુસ્તિકા)    | ૧-૦૦  |
| ૩૮. | દ્વિવ્ય ઔષધિ-૧                            | (ખીજુ આવૃત્તિ)      | ૧૦-૦૦ |
| ૩૯. | દ્વિવ્ય ઔષધિ-૨ (ચારસો વાનસ્પતિક પ્રયોગો)  | ૧૦-૦૦               |       |
| ૪૦. | દ્વિવ્ય ઔષધિ-૩ (૫૦૦ પ્રયોગો) (ખીજુ આ.)    | ૧૦-૦૦               |       |
| ૪૧. | નિત્ય નીરોગી (આહારવિષયક ઉપયોગી લેખો)      | ૭-૦૦                |       |
| ૪૨. | પુનઃ આયુર્વેદ પ્રતિ                       | (ખીજુ આવૃત્તિ)      | ૫-૦૦  |
| ૪૩. | ઘેરાશ                                     | (પરિયય પુસ્તિકા)    | ૩-૦૦  |
| ૪૪. | રાજિંદ્રી આયુર્વેદ                        | (પાંચમી આવૃત્તિ)    | ૧૦-૦૦ |
| ૪૫. | રાજિંદ્રા રોગો                            | (ત્રીજુ આવૃત્તિ)    | ૧૦-૦૦ |
| ૪૬. | વાળના રોગો (ખોડો, ખરતા વાળ, ધોળા વાળ)     | ૧૫-૦૦               |       |
| ૪૭. | વાળની સંભાળ                               | (પોટેટ ખુંક)        | ૧૦-૦૦ |
| ૪૮. | શિરઃશૂલ                                   | (ખીજુ આવૃત્તિ)      | ૫-૦૦  |
| ૪૯. | શૂલ                                       | (ખીજુ આવૃત્તિ)      | ૩-૦૦  |
| ૫૦. | સદ્ય ચિકિત્સા                             | (ઈમજ્ઝ-ન્સી સારવાર) | ૬-૦૦  |
| ૫૧. | સરૈદ દાગ                                  | (ધોળા ટોઢ)          | ૧૪-૦૦ |
| ૫૨. | સર્વોપયોગી ઔષધપેટી ((ખી.આ.) (સોળ ઔષધો))   | ૩-૦૦                |       |
| ૫૩. | સૌચે સમજવા જેવું (ઉપયોગી મનનીય લેખો)      | ૬-૦૦                |       |

આયુ પ્રકાશન : ૨૧૨-સર્વોદ્ય : અમદાવાદ-૧

નરમૂત્ર ગર્વ હણિ  
સેવિત સુરસાયનમ્બુ ।

માનવમૂત્ર ગરવિષ(કૃત્રિમ વિષ)ને હળ્ણે છે, હમેશાં સેવન  
કરવામાં આવે તો ઉત્તમ રસાયનનું ઈણ આપે છે.

—મહનપાલ નિધું-૨૧૭

## શિવામણુ-સેવનના મારા અનુભવો

‘દિવ્યામૃત રસાયનઃ શિવામણુ’ નામના મારા પુસ્તકની પ્રસ્તાવનામાં મેં મારા અનુભવો મુજબ અને તટસ્થપણે આપવાનું વચ્ચેન આપેલું. એક પ્રતિષ્ઠિત વૈદ્ય તરીકે તે અનુભવો વહેલી તરીકે જાળવાની અનેક વાચકોએ જિજાસા કરી મને પત્રો લખ્યા છે. ધણાને આશ્રયે પણ થયું છે. કેટલાય શિવામણુ-વિરોધી જિત્રો તે કારણે ગુસ્સામાં છે તો કેટલાય શિવામણુ ચાહેડો ખુશ છે.

(સન् ૧૯૮૭માં દિવાળી બાદ લાભ પાંચમના દિવસથી મેં સવારે એક વખત પીવા ઇપે શિવામણુ-સેવન શરૂ કરેલું. પ્રથમ દિવસથી કશી સૂગ કે પ્રતિક્રિયા વિના જાળે વર્ષોથી પીતો હોઉં તેમ શરૂ કરી શક્લો, તેનું કારણ કેદાય એ હશે કે બચપણમાં અમારે ધેર ગાયો હતી તેના જોમૂક્ત્રની ગંધની ટેવ હતી, કચારેક તે પીતો કે જલ પર મૂક્તો. વૈદ્ય હોવાને કારણે શિવામણુના ગુણનું શાન હતું. અનેક જતની કડવી કે અસ્વાદિષ્ટ તેમજ ઉચ્ચગંધી દવાથી ટેવાયેલ હતો અને સૌથી વધુ મુખ્ય કારણ તો મારી આહાર-વિહારની સાનુકૃતિના હશે; કારણ કે હું વર્ષોથી તીખું, ખાડું, ખાડું અને ગરમ ખાઈ શકતો નથી. માંસાહાર કે વ્યસનો સાથે મારે લગારેય પણ સંબંધ નથી. આહાર પથ્ય, ઓછો અને પ્રાય: મધુર લેવાનું

થાય છે તેથી મૂત્ર હુગ્નધ, રોગ અને ઉત્ત્રતારહિત હોવાથી કરી જ તકલીફ પડી ન હતી.

દેતાંની સાથે એ-ગણ દિવસમાં સ્કૂટિં, શક્કિં, મળ-શુદ્ધિ, રૂચિ અને પાયનને લગતા સારા અનુભવ થયા.

એક વર્ષ 'પીવાનુ' (સંયોગાવશાત કચારેક અવ્યવસ્થિત) શરૂ રાખ્યા બાદ અમદાવાદમાં આંખોનો ચેપી રોગ (કન્ઝકટીવાઈટીસ) શરૂ થતાં તેનાથી બ્યુવા આંખો આંજ્વાનું અને નેત્રપ્રકાલન પાત્રમાં ભરીને તેમાં આંખો એક મિનિટ બોળવાનું શરૂ કર્યું. પરિણામે તે રોગથી બ્યું શક્યો. ઉપરાંત નેત્રસ્નાનને કારણે દર્શિતમાં ફાયદો જણાતાં આઈ ગ્લાસથી બંને આંખો ધોવાનું ચાલુ જ રાખ્યું. તે સાથે મોંચાં તે દરમિયાન ડ્રાગનો ભરવાનું પણ ચાલુ કર્યું તેથી પ્રારંભે એક બે વર્ષ મુખ્યપાક જેવું થઈ મટી ગયેલું.

માલિશના અનુભવ કરવાની ઈચ્છા હતી પણ તે માટે સમય કાઢી શકાય તેમ ન હોવાથી આઈગ્લાસમાં વાપરેલું શિવાન્યુ જ માથે ચોપડું છું, ચહેરા પર લગાવું છું. કચારેક સહેજ બંને હાથે ચોપડું છું ને એથી વધારે હોય તે! પગના તળિયે ધસું છું.-બાથરૂમના ફરસ પર ઢાળી તેના ઉપર પગના તળિયાં ધસું છું.

મારા મિત્રશ્રી અનુભાઈ શાહના પત્ની સરોજબહેન રાહને શિરઃશળમાં નાક વડે પીવાથી ધાણી રાહત થતાં મેં પણ છએક માસથી થોડું નકિથી પીવાનું શરૂ કર્યું.

છે. આ બધા આંતરભાષા ઉપયોગથી નીચે અમાણે  
કાયદાં થયા :

૧. વાળ ઉપર અને મળજ પર અસર : વાળમાં  
પુનઃ કાળારીમાં વધારે થયો છે. સર્કેટ વાળની સંખ્યા  
ઘટતી જય છે. વાળ હીર જેવા સુંવાળા અને ખૂબ જ  
મજબૂત થયા છે. કચારેય એક પણ વાળ ખરતો નથી.  
માથામાં કચારેય ખંજવાળ આવતી નથી. એ વર્ષ પહેલાં  
જણે માથામાં સોરાયસીસ રાડ થશે તેમ જણાયેલું તે  
થોડા દિવસ ચોપડવાથી સાવ જ મટી ગયું. ટાક સ્થગિત  
થઈ ગઈ અને તેમાં થોડા વાળ જિગ્યા, માથાનો હુખાવો,  
ખી. પી. અને અદ્યપનિદ્રામાં રાહત થઈ છે. મનમાં શાન્તિ,  
સાત્ત્વિકતા અને સ્વસ્થતાનો જણે અનુભવ થાય છે.

૨. ચહેરા પર અસર : મેં પર સવારે ચોપડવાથી  
ચહેરાનું તેજ અને લાલાશ વધ્યા છે. ચહેરો લરાવદાર  
થયો છે. જમણા ગાલ પર સહેજ જાંખો કાળો ડાઘ  
(વ્યંગ) હતો તે લગભગ દૂર થઈ ગયો છે. મારા મિત્રશ્રી  
સુકુમાર વસાવડાના ચહેરા પર ચોપડવાના સારા અનુભવ  
પરથી મેં ચોપડવાનું રાડ કરેલ. ( અર્ધા ડલાંક બાદ  
સ્નાન થાય છે.)

૩. મેં તથા ગળા પર અસર : નેત્રસનાન દર-  
મિથાન એક મિનિટ ડે થોડા વધુ સમય ડોગળો (ગંડૂશ)  
ભરવાથી ગળામાંથી ચીકાશ નીકળો જય છે. દંતમંજન  
કયું હોય તેવા દાંત-મેં સાક થાય છે. રુચિ વધી છે.

સ્વર સારો થયો છે. (ને કે શિવામ્બુ ઉણુ ન પડે તે માટે તે બાદ અર્ધા ડલકી મૂળી કાળી દ્રાક્ષ અનુપાનદે આઉં છું તેણે પણ સ્વર-સુધારણામાં મદદ કરી હશે.)

૪. પાચનતત્ત્વ પર અસર : કેવળ સવારે નરણા એક કુપ જેટલું શિવામ્બુ પીવાને કારણે પાચનક્રિયા પર ધાર્ણીજ સારી અસર થઈ છે. રુચિ અને પાચન વધ્યા છે. ઓરાકનું પ્રમાણ વધ્યું છે. માઝક ન આવતાં આહાર ફર્યો પણ માઝક થવાં લાગ્યાં છે. શરૂઆતમાં તો તીક્ષ્ણાગ્નિ, ભસ્મમહાગ્નિ કે પરિણામશીળના દરદની જેમ ભૂખ લાગતાં ડાઈ મીળી વસ્તુ પેંડા, પઠવાન, સૂકો મેવો વગેરે આવાં જ પડતાં. લોજન અને નાસ્તાની સંખ્યા દિવસમાં પાંચ-છ વખ્ત થઈ જતી ! સ્વ. નટવરલાલ માળવીને અનુભવ થયો હતો તેમ જીવનમાં પહેલી જ વખ્ત ભૂખની તીવ્રતાનો ખ્યાલ આવ્યો. ખાંધું તે તુરત ‘સ્વાહા’ થઈ જતું. ચાલુ દરદી તપાસવાનું છોડી કચારેક તો અધવય કંઈ ખાઈ લેવા હોડવું પડતું !

૫. વજન પર અસર : ઉપરોક્ત આહારવૃદ્ધિ અને પાચન વધતાં જીવનમાં પહેલી વખ્ત જ વજન વધ્યું. ૧૬ વર્ષની ઉંમરથી ૪૬ થી ૪૮ કિલો નક્કી થઈ ગયેલું વર્જન ૫૪-૫૫ સુધી પહેંચ્યું. તેમાં અશ્વગંધા, શતાવરી જેવાં અનુપાને થોડી સહાયતા કરી હશે. ને કે શિવામ્બુસેવન પહેલાં પણ આવાં ઓષધો તો થેતો જ હતો.)

૬. શરહી દૂર થઈ : શરદ-હેમંત અને શિશીર-

વસાતના અંતુસંધિ સમયે ધણાં વર્ષોથી શરદી થયા કરતી હોય. ડી.ડી.ટી., ટેર્પેન્ટાઈન તેમજ ઉચ્ચ અતારો કે તેલોની તુરત એકનિંદા કરતી થઈ આવતી. પછી અવ્યવસ્થિત આહાર-વિહારના સંયોગોને કારણે કાખૂમાં આવતાં વાર થતી, ઉધરસ થતી અને પુષ્ટળ કંદ પડતો, કચારેક જાણે શાસ્ત્રનું પૂર્વીપ હોય તેવું લાગતું. શિવામ્બુ પાન-નસ્થ બાદ અઢી વર્ષોથી શરદી થઈ નથી. થાય તો હવે અર્ધા કે એક જ દુષ્ટસમાં શિવામ્બુના વધુ સેવનથી અને નાસાપાનથી મટી જાય છે.

૭. અમલપિતામાં આરામ : ત્રીસેઠ વર્ષોથી અમલપિતાનું દરદ હતું. શ્રીષ્મત શરદમાં તેને કારણે સખત પિતજ શિરઃશૂળ થતું. તેમાં પણ લગભગ ૮૦ ટકા જેટલો આરામ થઈ ગયો છે.

૮. અલડપ્રેસર સાવ મરચું : યારપાંચ વર્ષોથી ખાસ કરીને ઉનાળામાં અમલપિતના અનુસંધાનમાં અલડપ્રેસર વધી જતું કે ધરી જતું. તેમાં ઉપરનું ૧૭૦/૧૩૦ અને નીચેનું ૮૦/૬૦ સુધી પણ આંક ગયેલો. પરંતુ શિવામ્બુસેવન શરૂ થયા બાદ અઢી વર્ષોમાં સાવ જ નોર્મલ રહે છે. શિરઃશૂળ કે અમલપિત થોડા પ્રમાણુમાં કચારેક જણાય ત્યારે પણ નથી હોતું !

૯. ઊંઘમાં સમતા : ભારા શારીરિક અને માનસિક ઊંઘારણને કારણે મારી ઊંઘ ઓછી અને આછી હતી. શિવામ્બુસેવન બાદ તેમાં વધારો થયો છે. ઊંઘ તુરત અને ધસધસાટ આવે છે તેમાં વિક્ષેપ ધણો ઓછો થયો છે.

૧૦. પ્રોસ્ટેટમાં ફાયદો : પચાસ વર્ષની ઉભર બાદ પ્રોસ્ટેટ વધવાની શક્યતાથી બહુમૂત્રતા, મૂત્રાવરોધ, રાત્રે વધુ મૂત્રત્યાગ વગેરે તકલીફોના પ્રારંભ થયેલો પરંતુ શિવાભ્યુ લેવાથી તેમાં સારો કાખૂ આવી ગયો છે.

૧૧. પથરી નીકળવામાં સહાયતા : જમણી કિડનીમાં મને બે નાની પથરી થઈ હતી. તેની આયુર્વેદીય અવ્યવસ્થિત સારવાર લીધેલી. તેથી તે શિવાભ્યુથી જ નીકળો છે તેમ સ્પષ્ટ અને એક્સ ન કહી શકાય. પુણુ તેમાં સહાયક અવશ્ય થયેલ હશે તેમ માનું છું.

૧૨. વાંસી અંખમાં ચમતકારિક પરિણામ : મારી બે વર્ષની ઉંમરે મને સખત તાવ આવવાથી આંચડી આવેલી અને તેમાં મારી જમણી અંખ બેંચાઈ ગયેલી. ડુલળ બે પાંચ ટકા જ દાઢિ હતી. સામે ડાઈ બેદું હોઈ તેને એળખી શકતો ન હતો. મારી પાંચ અંગળા પુણુ બુરા-બર જોઈ શકતો ન હતો. શિવાભ્યુથી નેત્રસ્નાન ચાલુ રહેવાથી અચાનક તેમાં ફાયદો જણાયો. જમણી અંખમાં વીસેક ટકા જેટકી દાઢિ પ્રાપ્ત થઈ છે ! દૂરથી મોટા અક્ષરો પણ વાંચી શકું છું અને હથેળાની નાની નાની રેખા પણ જોઈ શકું છું ! એવો લાલ મેળવવા માટે મેને નેત્રપ્રક્ષાલનનો પ્રારંભ કર્યો જ ન હતો અને શિવાભ્યુ-ચિહ્નિત્સકોએ કચાંય બાવન વર્ષની આ જૂની બોડમાં સુધારો થયો હોય કે થઈ શકે તેનો સ્વીકાર કર્યો નથી. સાવ અસાધ્ય રોગમાં મને આ પરિણામ મળ્યું તેને હું શિવાભ્યુની હિત્યતાનો ચમતકાર જ કહી શકું. મારી

ડાખી બાંધે ચરસમાના અઠી નંબર છે. તેમાં પણ એકાઈ કે અધી નંબર ધટચો હશે. તેવું મને લાગે છે. કારણ કે ચરસમાં વિના પણ તેનાથી હવે વાંચી શકું છું! મને લાગે છે કે બંને આંખોમાં દિનપ્રતિદિન સુધારો થતો જ જરો.

૧૩. અન્ય કાયદા : ઉપરોક્ત રૂપ્યામ ઉપરાંત શિવાભ્યુ સેવનથી મને કબજીયાતમાં કાયદો જણાયો છે. ત્વચા પર ડચાંથ ખૂંજવાળ આવે કે ચમ્ભરાગ દેખાય તે લગાડવાથી તેમાં રાહત અનુભવી છે. સદ્ગરણ, વાગવું, છાલાવું વગેરેમાં કેવળ બેચાર દિવસ શિવાભ્યુ લગાડવાથી આરામ થઈ જય છે. કાનની કોઈ તકલીફમાં ટીપાં નાખવાથી તરત જ પ્રેરન હલ થઈ જય છે. કોઈ અંગમાં દુખાવો થાય ત્યાં ચોળવાથી સારું પરિણામ આવે છે. શિવાભ્યુસેવન બાદ કોઈ પણ કંતુજન્ય કે સંકામક રોગનો જથું લાગતો નથી. સ્વાસ્થ્ય અને રોગ નિવારણનો જણું વિમો ઉત્તરાવી લીધો હોય તેવી ધરપતનો મનમાં અનુભવ થાય છે. સમયના અલાવે છચ્છા છતાં શિવાભ્યુ-અન્યાંગનો બિલકુલ અનુભવ કરી શક્યો નથી.

ઉપરાંથી હું આયુર્વેદ ક્ષેત્રમાં ઓતપ્રોત છું. અન્ય શ્રદ્ધા ધરાવું છું. હજનરો દરદીને આયુર્વેદીય સારવારથી સાંજ કર્યા છે. સેંકડો ઔષધોના ગુણુદ્દેષ મોઢે છે. છતાં એક જવાબદાર વૈદી તરીકે મારે મુક્ત રીતે વાચકો અને શિવાભ્યુ ચાહકો આગળ કુઝૂલવું જોઈએ કે શિવાભ્યુસેવન એ આયુર્વેદની એક શાખા હોવી છતાં તે અનેક રોગોમાં વધુમાં વધુ અને વ્યાપકમાં વ્યાપક

પરિણામદાયી ઔષધ છે. જે કે સમયના અભાવે મેં અન્ય દર્દીઓને શિવાભ્યુ સારવાર આપવાનું કે સક્ષાણ આપવાનું હજુ શરીર કંદું નથી. કરું તો, શ્રી આમસ્ટ્રોંગ કોવા જ અનુભવે થાય તેની મને ખાતરી છે.)

\*

શિવાભ્યુ-સેવનના આ પ્રથમ લાગ ઉપરાંત બીજી તણુ લાગમાં મેં શિવાભ્યુ વિષે ખૂબ જ કંબાળુથી વ્યવસ્થિત તથા ઉડાળુથી ચર્ચા કરી છે. તે વાંચીને શિવાભ્યુ પ્રત્યે તો વાચ્યકોને સંમાન વધવાનું જ છે પણ આયુર્વેદના સિદ્ધાન્ત પ્રત્યે પણ સંમાન વધશે જ.

આ ચારેથ લાગના સારાંશ ઇપે 'શિવાભ્યુ સારાંશ' પુસ્તક પણ મેં તૈયાર કંદું છે જેથી ટૂંકમાં અને ઓછા ખર્ચમાં જરૂરી જ્ઞાન મેળવવું હોય તે મેળવી શકે. તેની એક કલાકની ઓડિયો ફેસેટ પણ પ્રગટ કરી છે.

આવરણ ઉપર શિવાભ્યુ-સેવનનો ઝાટો આપનાર શ્રી અન્જિત સોલ્ફાંકી મારા દર્દીમાંથી મારા મિત્ર બનેલા છે. ૨૦ વર્ષથી શિવાભ્યુસેવન કરે છે ત્યારથી કદી બિમાર પડ્યા નથી. દવા પાછળ એક પાઈ પણ ખર્ચ નથી. ઝાટો આપવા બદલ તેમનો આખાર વધુકતા કરું છું.

'આયુ સેન્ટ્રા'

૨૧૨-સર્વોદય, અમદાવાદ-૧

—શોલન

૧૨-૧૨-'૮૬

# શિવાન્ધુ-સેવન

( ભાગ પદ્ધતિ )

—શાલન

# શિવામણુ-સેવન

( લાગ પહેલો )

|   |          |
|---|----------|
| ૧. શિવામણુ...                                 | ૧ થી ૨   |
| ૨. શિવામણુ-પર્યાય...                          | ૩ થી ૬   |
| ૩. શિવામણુનું સર્જન...                        | ૭ થી ૧૭  |
| ૪. શિવામણુમાં સતત પરિવર્તન...                 | ૧૮ થી ૩૦ |
| —શિવામણુ પર આહારની અસર                        | ૧૮       |
| —શિવામણુ પર વિહારની અસર                       | ૨૪       |
| —શિવામણુ પર ઝડુ-કાળની અસર                     | ૨૫       |
| —શિવામણુ પર રોગોની અસર                        | ૨૭       |
| —શિવામણુ પર ઔષધેની અસર                        | ૨૮       |
| ૫. આયુર્વેદમાં શિવામણુ...                     | ૩૧ થી ૭૮ |
| —શિવામણુ...ત્રિહાષની દર્શિયે                  | ૩૩       |
| —શિવામણુ...રસોની દર્શિયે                      | ૩૮       |
| —શિવામણુ...ગુણોની દર્શિયે                     | ૪૩       |
| —શિવામણુ...વીર્યની દર્શિયે                    | ૪૭       |
| —શિવામણુ...વિપાકની દર્શિયે                    | ૪૭       |
| —શિવામણુ...પ્રલાવની દર્શિયે                   | ૫૦       |
| —શિવામણુ...અન્ય ગુણ-ક્રમોની દર્શિયે           | ૫૧       |
| —શિવામણુ...રોગહરત્વની દર્શિયે                 | ૬૨       |
| —સર્વમૂત્રના સામાન્ય ગુણ                      | ૭૦       |
| —શિવામણુ...ઔષધયોજના રૂપે                      | ૭૭       |
| ૬. આયુર્વેદમાં શિવામણુ-ગુણ સારાંશ... હટ થી ૮૦ |          |

# શિવાન્ધુ-સેવન

## ૧ શિવાન્ધુ

‘શિવ’ અને ‘અન્ધુ’ એ એ શાખદો મળાને ‘શિવાન્ધુ’ શાખદ અન્યો છે. શિવ એટલે કુદ્યાણુકારી. અન્ધુ એટલે જળ, પાણી અથવા પ્રવાહી. તેથી શિવાન્ધુનો સરળ પર્યાય-ગુજરાતી અર્થ ‘કુદ્યાણુકારી જળ’ થાય. સંસ્કૃતમાં મૂત્રેન્દ્રિય અથવા લિંગનો અર્થ પણ શિવ છે. એટલે લિંગમાંથી બહાર આવતું પાણી, એટલે એ રીતે પણ શિવાન્ધુ કહી શકાય. શિવ એટલે ભગવાન શાંકર. ખુદ શિવે જ સ્વસુષે અન્ધુનું વર્ણન કર્યું છે, વખાળ કર્યા છે તેથી પણ શિવાન્ધુ કહી શકાય. આ કારણે તેનાં શિવાન્ધુ ઉપરાંત શિવ, જલ, શિવતોથ, શિવવારિ વગેરે શિવ શાખદ સાથે પાણીના બધા જ સંસ્કૃત પર્યાય લગાડી અનેક નામ બનાવી શકાય. જેમણે, શિવવારુણી, શિંવદ્રવ, શિવોદ્ધિ, શિવામૃત, શિવજળ વગેરે. ખુદ શિવે તેનું વર્ણન કરી પ્રસાદરે આપણને આપ્યું છે તે કારણે તેને ‘શિવપ્રસાદ’ પણ કહેવામાં આવે છે.

સ્વમૂત્ર સંબંધિત સર્વોપ્રથમ સાહિત્ય 'શિવામ્બુ-કુલ્પ' કુલે પ્રાય: પુરાણુઠાળમાં એટલે કે આજથી પાંચેક હજાર વર્ષો પહેલાં લખાયેલ છે. તેમાં ભગવાન શિવે પાર્વતીને સંખોધન કરી એકસે સાત શ્લોકા લખ્યા છે તે પુસ્તકનું જ નામ 'શિવામ્બુ-કુલ્પ' હોવાથી આજે પણ એ પર્યાયનો સૂવીકાર અને પ્રચાર કરવામાં આવ્યો છે. કારણ કે તે પર્યાય મધુર છે, અર્થવાહી છે, પવિત્રતાના સ્પર્શવાળો છે, ધાર્મિક છે અને સંસ્કૃતભાષી હોવાથી ભારતવર્ષ માટે માન્ય છે; વળી તે સૌને ગમે તેવો અને સૂગ ન ઉપભવે તેવો છે. તેથી સ્વમૂત્ર, નરમૂત્ર, માનવમૂત્ર, મૂત્ર, પેશાવર વગેરે નામને બદલે 'શિવામ્બુ' નામ આજે સર્વોત્તમ સર્વ-માન્ય બની ગયું છે.



## શિવામ્બુના-પર્યાય

પ્રાચીન સંસ્કૃત સાહિત્ય ઉપરથી, આયુર્વેદ સાહિત્ય ઉપરથી, ભારતીય આધુનિક બોલયાલની ભાષા ઉપરથી કે તેના સવિશેષ ગુણુ ઉપરથી શિવામ્બુના નિર્મનોક્ત અનેક પર્યાય છે.

**૧. અમરવારુણી :** અમરત્વ આપનારુ ૭૩. વારુણી એટલે ૭૩, દ્વા કે પ્રવાહી.

**૨. અમરોલી :** યોગીઓ, હડયોગીઓ, સાધુઓ, જંત્યાસીઓ, અધોરી બાવાઓ, તાંત્રિકો વગેરેએ પ્રાચીન-યુગમાં શરીરને અમર કરવા, અમરતા આપનાર અમૃત સ્વરૂપ શિવામ્બુ પર ખૂબ ૫૮ સંશોધન કરેલું. યોગસાધના કરતાં પહેલાં કે ફોર્ટપણ સિદ્ધિ પ્રાપ્ત કરતાં પહેલાં તે અણુલી પ્રમાણે શિવામ્બુસેવનને। ૫ પ્રયોગ અમરતા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતો તેને તેએ ‘અમરોલી’ કહેતા જે નામે હિન્દીમાં એક પુસ્તક પણ પ્રગટ થયેલ છે.

**૩. અમૃત :** શિવામ્બુમાં આરોગ્યપ્રદ, આયુર્યવર્ધક, રોગનિવારક રસો અને ગુણો હોવાથી તેને ‘અમૃત’ પણ કહેવામાં આવે છે. શિવામ્બુસેવનથી અમરતા પણ પ્રાપ્ત થઈ શકે તેવો પણ ‘શિવમ્બુ-ફલપ’માં નિર્દેખ હોવાથી અને ‘શિવમ્બુ ચામૃતં દિવ્યं’ ૫૨રોગવિનાશનમ् (૫લોક-૬)-શિવામ્બુ અમૃત છે, દિવ્ય છે અને ઘડપણું તથા રોગનો વિનાશ કરનારું છે.’ એમ કહેલ હોવાથી અમૃતસમાન ગુણવાળા શિવામ્બુને પણ અમૃત કહેવામાં

આવે છે. ધન્વન્તરિ નિધંડુ અને રાજ નિધંડુમાં જળનો પર્યાય ‘અમૃત’ છે.

૫. અમૃત સંજીવની : ઉપર જોયું તેમ શિવામણુનો પર્યાય ‘અમૃત’ છે. અમૃત માંદા કે મરવા પડેલાને સજીવના કરતું હોવાથી આવા અર્થસહિત સુંદર નામે વખણ્યાય છે.

૬. અંગિરસ : ‘અંગી’ એટલે અંગ અથવા શરીર. શરીરમાંથી નીકળતો રસ. અથવા અંગ યા લંગમાંથી નીકળતો રસ. જેને જીવનરસ પણ છૂટી શકાય. પ્રાચીન અંગિરા ઋષિ શિવામણુ ઉપર જીવન નિર્વાહ કરતા તેવી ભાન્યતા ઉપરથી પણ અંગિરસ પર્યાય હોઈ શકે. રાજનિધંડુમાં જળનો પર્યાય ‘રસ’ પણ જણાવ્યો છે.

૭. ગુણ્ય નિષ્ઠંદ : ગુણ્ય અંગમાંથી નિષ્ઠંદન થઈને – ગળાઈને બહાર આવતું પાણી અથવા પ્રવાહી. આહારપાચનમાંથી ધૂકું પડેલું પાણી આંતરડામાંથી જવા જવીને (જેમ ગોળામાથી પાણી ટપકે તેમ) બાસ્ત (ઝલેડર) માં આવીને ગુણ્ય માર્ગ (જાતીય અંગ) દારા મૂત્રદ્વારે બહાર આવતું હોવાથી તેને ‘ગુણ્ય નિષ્ઠંદ’ કહ્યું છે. ધન્વન્તરિ નિધંડુમાં આ પ્રમાણે આ શિષ્ટ મૂત્રના પર્યાય દ્વારા થયો છે :

મૂત્રં તુ ગુણ્યનિષ્ઠંદः પ્રસ્તાવः પ્રવણઃ સ્લબઃ ।

—ધન્વન્તરિ નિધંડુ, દુદો સગ્રાલો. ૪૮૬

મૂત્રના ગુણ્ય નિષ્ઠંદ, પ્રસ્તાવ, પ્રવણ, સ્લબ પર્યાય છે.

૮. જીવન જળ : શિવામણુ જીવન આપનારું હોવાથી જીવનસહિત સેવન કરવા યોગ્ય હોવાથી તેને ‘જીવન જળ’

## શિવામ્બુસેવન

કહેવામાં આવે છે. આ પર્યાય ખાસ તો અંગેજ સાહિત્યના અનુવાદ રૂપે આવેલો છે. શ્રી આમંસ્ટ્રોંગ નામના અંગેજ શિવામ્બુ વિષયક ખૂબ જ પ્રઘણાત ‘ધી વોટર એઓઝ લાઈઝ’ નામે પુસ્તક લખ્યું છે. તેનો અનુવાદ ‘જીવન જળ’ થતો હોવાથી અને તે નામે ગુજરાતીમાં પણ પુસ્તક પ્રગટ થયેલ હોવાથી જીવન જળ શાખા ડીક્રિક પ્રચારિત છે. રાજ્યનિધિદુમાં ‘જીવન’ અને ‘જળ’ બંને પર્યાય પાણી માટે પ્રયોગ્યા છે.

૮. જીવન રસ : જળનો એક પર્યાય રસ હોવાથી અને કોઈ પણ દ્વારા રસ પર્યાય આપી શકાતો હોવાથી આગળના પર્યાય ‘જીવન જળ’ ઉપરથી તેને ‘જીવન રસ’ પણ કહેવામાં આવે છે. રાજ્યનિધિદુમાં ‘જીવન’ અને ‘રસ’ બંને પર્યાય જળ માટે આપેલા છે.

૯. નરમૂત્ર : નર એટલે પુરુષ. સ્ત્રી-પુરુષના મૂત્રમાં પુરુષમૂત્ર વધુ ગુણવાળું અને ત્રાણ હોવાથી માનવમૂત્રને આયુવેદે નરમૂત્ર તરીકે ઉલ્લેખયું છે.

૧૦. નરામ્બુ : ‘નર’ અને ‘અમ્બુ’ શાખા મળીને અનેલ આ શાખાનો અથ ઉપર પ્રમાણે છે.

૧૧. નૃવારિ : ‘નૃ’ એટલે ‘નર’ અને ‘વારિ’ એટલે જળ અથવા મૂત્ર. ઉપર પ્રમાણે અથ સમજવો.

૧૨. પ્રસ્તાવ : સ્ત્રાવ એટલે બહાર નીકળતું. શરીરમાંથી ખાસ પ્રકારના સ્ત્રાવ રૂપે બહાર આવતા મૂત્રને ધ્યાનવન્તરિ નિધિદુમાં ‘પ્રસ્તાવ’ કહેલ છે.

૧૩. માનવમૂત્ર : વ્યાપક અથ કરીએ તો માનવ-

જાતિનું મૂત્ર, જેમાં નર-નારી અંગેનાં મૂત્રનો સમાવેશ સ્થાયે જ થઈ જય છે.

૧૪. સ્વષ્ટ : 'પ્રસ્તાવ' પ્રમાણે.

૧૫. સ્વષ્ટશુ : 'પ્રસ્તાવ' પ્રમાણે.

૧૬. સ્વમૂત્ર : 'સ્વ' એટલે પોતાનું. વ્યક્તિઓ પ્રાયઃ પોતાના જ મૂત્રનો પીવા વગેરેમાં ઉપયોગ કરવાનો હોવાથી આ શાખા વધુ પ્રચલિત થયેલો છે.

૧૭. સ્વ-રસાયન : [શિવામ્બુદ્ધમાં રસાયન ગુણું હોવાથી પોતાને જ પોતાનો રસાયન ગુણું મળતો હોવાથી સ્વરસાયન કહેવામાં આવે છે.]

અંગ્રેજીમાં મૂત્રનો પર્યાય કુરિન (Urine) હોવા છતાં તેમાં પણ તેના વિશેષ ગુણને કારણે 'લાઈઝ વોટર' તથા 'મેજિક ઇલ્યુઇડ' પણ કહેવામાં આવે છે.

મૂત્રનો હિન્દી પર્યાય મૂત્ર, મૂત અને પેશાખ છે. પેશાખ પર્યાય ગુજરાતીમાં 'મૂતર' જેટલો જ પ્રચલિત છે.

પર્યાય માટેના સર્વોત્તમ અને પ્રાચીન આયુર્વેદીય નિધંડુ 'ધન્ત્વન્તરિ નિધંડુ' અને રાજનિધંડુ'માં મૂત્રના અને પાણીના પુષ્કળ પર્યાય આપેલા છે. તે ઉપરથી શિવામ્બુના અનેક નવા પર્યાય આપી શકાય. જેમણે... શિવપાનીયમ्, શિવાપઃ, શિવનીરમ्, શિવસલિલઃ, શિવ-તાયમ्, શિવવારિ, શિવામ્લો, શિવાદ્દક, શિવપુયઃ, શિવપ્રસેક વગેરે.



ॐ

## शिवाम्भुतुं सर्जन्

आपणा मानवशरीरमां शिवाम्भुतुं सर्जन् (मूर्त्ति-  
निर्माण) કेवी રીતે થાય છે તે જગ્ઘાવું તે શિવામ્ભુતું  
સેવન કરનાર માટે જરૂરી છે.

પહોળા આશાય મધ્યસ્થં પિતાં ચતુર્વિધમન્નપાનં  
પચાત ત્રિવેચ્યયતિ ચ દ્વાષરસમૂત્રપુરીષાણિ ॥

—સુશ્રુત સંહિતા સૂત્ર-૨૨/૧૦

પહોળા આશાય અને આમાશાય વર્ણે રહેલ પિતા (જડરામિ  
અથવા વૈશ્વાનર) ચારેય જલતના (પેય, ચોસય, લોજય  
અને ખાદ્ય) અન્નપાનને પ્રયાવે છે. અને પછી તેમાંથી  
વાત-પિત-કંઈ એ નાણું દ્વાષો, રસાદિ ધાતુ, મૂત્ર અને મળ  
વગેરેને છૂટા પાડે છે.

**વિષમૂત્રમાહારમલઃ ।-**(સુશ્રુત સૂ. ૪૬/૫૨૮)  
અનુસાર મળ અને મૂત્ર એ બ'ને આહારમાંથી ઉત્પન્ત  
થતા મળ છે. ચરક સંહિતા (ચિહ્નિત્સા અધ્યાય ૧૫/૧૮)  
માં પણ ‘કિંદમન્નસ્ય વિષમૂત્રમ ।’- એટલે કે ખાદ્યલા  
એઠાકના કિંદલાગમાંથી મળ-મૂત્ર બને છે. ચરક સંહિતા  
(સૂ. ૨૮/૪)માં આ સૂત્રને વધુ સમજ શકાય તેવું સર્વ  
છે.—

‘તત્ત્વાહારપ્રસાદાખ્યો રસઃ કિંદં ચ મલાખ્ય  
મલિનિવર્તતે । કિંદાત સ્વેદમૂત્રપુરીષઃ પુષ્યનિત ॥

આંતરડામાં રસ અને મળનું વિલાજન થાય છે ત્યારે આહારના પ્રસાદ (શુદ્ધ અંશ)ને રસ કહે છે. જ્યાદે બાકી રહેલા કિંટ (બાકીનો અશુદ્ધ અંશ)ને મળ કહે છે. આ કિંટ ભાગમાંથી પસીનો, મૂત્ર કે મળ બને છે. અષ્ટાંગસંગ્રહ (સૂત્રસ્થાન)માં પણ કહ્યું છે, 'અન્તનકુલેદ્ધ નિર્વાહુણેન મૂત્રમ् ।- અન્તમાંથી ને કલેદ્ધ (પ્રવાહી અંશો) વાળો ભાગ વહી બસ્તિ (મૂત્રાશય)માં આવી મૂત્ર બને છે.' શાર્ધર સંહિતા (પૂર્વખંડ ૬/૬)માં આ વાત ખૂબ જ સ્પષ્ટ લખી છે. જેનાથી મૂત્રનિભાણનો પૂરો ખ્યાલ આવી જય છે :

આહારસ્થ રસः સારः સારહુનો ભલદ્વઃ ।  
શિરાલિસ્તજજલઃ નીતઃ બસ્તૌ મૂત્રત્વમાણુથાત ॥

આહારનો પોષક ભાગ (સાર) રસ(ધાતુ) કહેવાય છે. તે સાર ભાગ જુદ્દો પડચા બાદ બાકી રહેલ મળ ભાગનો જલિયાંશ (દ્વલભાગ) મૂત્રવાહિનીએ (ગવિનીએ) દ્વારા બસ્તિમાં લઈ જવામાં આવે છે અને ત્યાં બસ્તિમાં તે જલિયાંશ (પાણી)ને મૂત્ર નામ આપવામાં આવે છે.

અથવાવેદ (૧-૧-૩)માં આ વાત નાનકડા સૂત્ર દ્વારા આ પ્રમાણે કહેવાયેલ છે. 'યદાન્ત્રેષુ ગવીન્યોઽય્દુ  
અસ્તાવધિસંશ્રિતમ् એવા તે મૂત્રમ् ।-ને પ્રવાહી મળ  
ભાગ આંતરડામાંથી ગવિનીએ (મૂત્રનલિંગાએ-યુરેટસ-  
Ureters) દ્વારા બસ્તિમાં એકત્રિત થાય છે તેને મૂત્ર  
કહેવામાં આવે છે.

શાર્દુંગધર સંહિતાના ટીકાકાર આઠમલે મૂત્રોત્પાદનમાં વૃક્ષ (કિડની)ની વાત આ રીતે કરી છે:

‘આહારજલવાહિ સિરાધારૌ તિલવૃક્ષૈ ।-

આહારમાંના જલીય અંશને વહન કરનારી શિરા-  
ઓનો આધાર વૃક્ષ છે.’

આજનું શરીરવિશાન પણ શિવામૃદ્ધ સર્જનની આ  
વાતમાં સહમત છે. તે પણ કહે છે કે યુરિન બંને  
કિડનીમાં ગળાઈને તૈયાર થાય છે. લોહી શુદ્ધ થવા કિડનીમાં  
આવે છે ત્યારે તેમાં ભેદેલાં વિઝતીય દ્રવ્યોને દૂર કરવાનું  
કાર્ય તેમાં રહેલા ‘નેફ્રોન’ નામના અગણિત ડેંબો કરે  
છે. એ રીતે ફિલ્ટર થયેલું મૂત્ર બંને મૂત્રવાહિનીઓ દારા  
ટપકી ટપકીને મૂત્રાશયમાં એકદું થાય છે.

સંશોધકો કહે છે કે કિડનીનો રોગ થયો હોય તે  
વ્યક્તિનું મૂત્ર પણ તેની કિડનીમાંથી ગળાઈને જ આવતું  
હોય છે. એ રીતે કિડની આ વિશ્વની નાજુક, શુદ્ધ અને  
અતિ વિકસિત કુદરતી સર્વેતમ ગળણી છે. આધુનિક કોઈ  
ફિલ્ટરેશન તેની બરાબરી કરી ન શકે. જેની અદ્ભુત  
રૂચનાના અનેક રહસ્યો હજુ પણ વૈજ્ઞાનિકો શાધી શક્યા  
નથી !

આધુનિક શરીરવિદ્યાના છેલ્કા સંશોધન પ્રમાણે રસ-  
રક્તમાંથી મળીને જુદા પાડવાનું, તેને પોતપોતાનું સ્વતંત્ર  
રૂપ (ઇમ્) આપવાનું કાર્ય ક્ષિવરનું છે. તેમાંથી મળભાગ  
પુનઃ રક્તપ્રવાહમાં આવી કિડનીમાં જઈને ગળાય છે.

प्राचीन प्रथम शरीरशाता महाशत्रवैद्य सुश्रुते (निहान  
३, २०-२३)मां भूत्रोत्पत्तिनी २७स्थपूर्ण वात आ शष्टोभृ  
दूँकमां करी छे :

पठवाशयगतास्तत्र नाड्यो भूत्रवष्टास्तु याः ।  
तप्यन्ति सदा भूत्रं सरितं सागरं यथा ॥  
सूक्ष्मत्वान्नोपक्षस्यन्ते भुज्ञान्यासां सहस्रशः ।  
नाडीलिङ्गपनीतस्य भूत्रस्याभाशयान्तरात् ॥  
ज्ञन्तः स्वपतश्वैव स निःस्यन्देन पूर्यते ।  
आभुज्ञात्सक्षिले न्यस्तः पाश्वेभ्यः पूर्यते नवः ।  
धटा यथा तथा विद्धि अस्ति भूत्रेणु पूर्यते ॥

जेम सरिताओ सागरने जरती २हे छे तेम भूत्रवाहिनी  
नण्ठाओ पठवाशयमां जैर्घने त्यां भूत्रने सदा वृधारती २हे  
छे. भूत्रनु वृहन करनारी ऐ धमनीओानी शाखाइप अन्य  
हुज्जरो नलिकाओ छे. तेमना हुज्जरो भुज्ञ सूक्ष्म हेवाथी  
ज्ञेई शकातां नथी, आभाशयना अंदरथी नाडीओ ए  
आणेलु भूत्र ऊवाथी भूत्राशय जराया करे छे. जेम में  
बहार राखीने पाणीमां दूबलो नवो धडो पेताना पउखां-  
मांथी शोषातां जण वडे जराय ज्य छे तेम भूत्राशय नीचे  
रहेला भुज्ञवाणु हेवा छतां उपर तरक्ष्यी (सरवाणी इपे)  
प्रवेशता भूत्रथी जराई ज्य छे.

सरण, स५७८ अने अंतिम संशोधनोनो साथ लघुन  
दूँकमां शिवाभ्यु-सज्जननी वात कहेवी हेय तो आ शष्टोभृ  
कुणी शकायः

મૂત્રસર્જનનું મુખ્ય અંગ છે મૂત્રપિંડ. એને વૃક્ષ પણ કહેવામાં આવે છે. આજે એનો અંગેણું પર્યાય કિડની વધુ પ્રચલિત હોવાથી તેનો વધુ ઉપયોગ કરીશું.

કિડની પેટની પાછળી દિવાલ પર કમરમાં ઉદ્દરપટલ (ડાયાઝામ)થી થોડું નીચે કરેડરજજુની બંને બાજુ ઉદરનું ગૃહામાં એટલે કે જમણા અને ડાબા પડ્યે સામે સામે રહેલ છે. તેનો આકાર કાજુ જેવો હોય છે. તેનું કેદ બંધ મૂળી જેવડું એટલે કે તેની લંબાઈ ચાર દિયા, પહોળાઈ અઠી દિય અને જડાઈ હોઢ દિય હોય છે.

આ આખીય કિડનીમાં ‘નેફ્રોન’ નામની અતિ સૂક્ષ્મ નણીઓના ગુંચળાં ગોડવાયેલાં હોય છે. જેને સીધાં કરીને લંબાવવામાં આવે તો લગભગ સિતેર માઈલ લાંખી નણીઓ થાય ! ટેલિઝૈનના ટોડ વાયરની જેમ એ દિયની લંબાઈ-વાળા નેફ્રોનની સંખ્યા દરેક કિડનીમાં લગભગ દસ દસ લાખની છે ! તે નલિકાઓ એટલી બધી પાતળી હોય છે કે આજુબાજુમાં છસો જેટલી નણીઓ ગોડવીએ તો પહોળાઈ કેવળ એક દિયની થાય ! રક્તશુદ્ધિનું કાર્ય બરાબર થઈ શકે, મૂત્રોત્પત્તિ બરાબર થઈ શકે તે માટે કુદરતે નેફ્રોનને વાંકાચુંકા ગુંચળા રૂપે ગોડવ્યા છે.

શરીર આખામાં કેવળ નેફ્રોનના ટોષો જ લોહીમાંના વિષ દ્વયો અને વ્યથ દ્વયોને શરીરમાંથી બહાર હેંકવાની કરજ બન્ને છે. આ કિયા રસાક્ષણ, પ્રસંગ કે દબાળ જેવી સાઢી, સરળ અને ધાર્ત્રિક નથી પણ નેફ્રોનના પ્રત્યેક છાષ પેતાની સમજનો ઉપયોગ કરી શરીરને ઉપયોગી

હોય તને લોહીમાં આગળ વધવા હે છે અને અનુપયોગી હોય તને મૂત્ર વાટે બહાર ફેંકે છે. જેના કારણે શર્કરા, આદખ્યમીન, ૨૦૪કુણો અને અનેક જીતનાં પોષક દ્વારો લોહીમાં સચવાઈ રહે છે.

રક્તપરિબ્રમણક્રિયામાં રક્ત ફરતું ફરતું જેવું કિડનીમાં આવે ત્યારે તેની ફેશવાહિનીઓમાં રહેલા નેઝોનના એક છેડા વડે પાણી અને ક્ષારો ગળાવા માંડે છે. સતત ક્રિયા-શીખ આ અસંખ્ય નેઝોના દ્વારા હમેશાં ૩૦૦ લિટર જેટલું પાણી અળાય છે! અને નેઝોનાના પાછલા છેડે તે પાણી પાછું શોષાઈને ફેશવાહિનીઓ દ્વારા પાછું રક્તમાં ઠંકવાયા કરે છે. કેવળ તેમાંથી એ લિટર જેટલું મૂત્રદ્વારા મૈાંકલવા રોકી હેવામાં આવે છે. એ કારણે કિડનીને વિશ્વનું સૂક્ષ્માતિસૂક્ષ્મ, ચોક્કસ અને કુદરતી ફિલ્ટરેશન (ગલણી) ગણવામાં આવે છે.

ખૂબ જરૂરિય એવા એ નેઝોનની મદદથી કિડની ચાર કાર્યો સતત કરતી રહે છે.

૧. તે લોહીને શુદ્ધ કરે છે અને વિષાક્ત કે નિર્ધર્થક દ્વારે બહાર ફેંકી હે છે.

૨. લોહીમાંથી એસિડ સેડિયમ ઇસ્ટેટ ગાળા લઈ તને આદકલી રાખવાનું તેનું ખીજું કાર્ય છે.

૩. શરીરમાંનાં રાસાયનિક દ્વારો, પાણી તથા મીડાને સમતોલ રાખે છે.

૪. શિવાભૂનું સર્જન કરે છે.

૫. જળ તરબ અને અજિન તરબ પર નિયંત્રણ રાખે છે.
૬. લોહીમાં સાકરની સપ્રમાણુતા જળવે છે.

હૃદય અને ઈક્સાં બાદ મહારવનું આ ત્રીજું મર્મસ્થાન: -કિડની સર્વાદુ કાર્ય કરી ન શકે તો યુરિયા અને યુરિક ઓસિડનો નિકાલ ન થતાં લોહીમાં જમા થવા માંડે છે અને સરવાળે યુરેમિયા (Uremia) રોગ થવાથી જેરી અસરને કારણે દરદી બેલાન થઈ મૃત્યુ પામે છે. જેને 'કિડની ઇથીલ' કહેવામાં આવે છે.

કિડનીમાં શિવાભૂ સજનની પ્રક્રિયા ઘણી જ જરૂરિયા છે. તેમાં પહેલાં તો લોહી નેઝોનના સુખ્ય સંયોજન ઘટકો સોયના કાળ્યા જેવા સૂક્ષ્મ રીનલ ટચુષ્યુલસ-ગ્લોમેચ્યુલસમાં જથું છે. તે ખૂબ બારીક હોવાથી તેમાં ખૂબ બારીક મેલ્લિંકચુલ્સ જ પસાર થાય છે. તે પસાર થયેલા ગળાયેલા દ્રવને 'કાજમા' કહેવામાં આવે છે. જેમાં પાણી, માંગું અને ખીજ સૂક્ષ્મ મેલેકચુલ્સ હોય છે.

મુત્ર થવા સિવાયનો બાકીનો મોટો જથ્થો પાછો જથું છે. રીનલ ટચુષ્યુલસ સાથે સંકળાયેલ સૂક્ષ્મ ફેશવાહિનીએ દ્વારા રક્તમાં શુદ્ધિકરણની પ્રક્રિયા દરમિયાન શિવાભૂ અનેક જતના હેમેન્સ, નર્વ્સ રાસાયનિક દ્રવ્યો તેમજ સંપૂર્ણ શરીરના પ્રલાવમાં આવે છે.

કાજમા ઘણ્યા સુશ્કેલ માર્ગ નેઝોનની સૂક્ષ્મ દિવાલની ડાયોમાંથી ગળાય છે. તેમાંથી ગળાતી વખતે પાણી, ન્યુ-ગ્રીએન્સ તેમજ જવનસર્વ ફીરી રક્તમાંથી શોષી લેવાયું

છ. છેલ્સે અમેનિયા, યુરિયા વગેરે પદ્ધાર્થી જ બાકી રહે છે.

કિડનીની બિમારી ગંભીર કે જીવલેણું ન નીવડે તે સાટે એ કિડનીનું કુદરતે સર્જન કયું છે. ઉપરાંત તેમાં એવી પણ રચના છે કે ગંભીર અવસ્થામાં કિડનીનો નાનઠડો લાગ પણ કિડનીનું બધું કામ સંલાળી શકે!

કિડની જળતરવ અને અનિન તરવ પર નિયંત્રણ રાખતી હોવાથી હાઈપરટેન્શન, ફંદયરોગ, કુમેટિક હાટ વગેરે થતા અટકે છે. ચેપી રોગો જેવા કે ગાલ્પચોલાં, ગ્રીથેરિયા(કંદરાહિણી), ટાઇઝ્એંડ વગેરે દરમિયાન કિડનીમાં બળતરા થાય છે કારણ કે ત્યારે નેઝોન નિષ્ઠિય થાઈ જવાથી વિષતરવો કે વ્યય દ્વારાનો નિકાલ થઈ શકતો નથી.

રાગિષ્ટ કિડનીને આરામ આપવા તેનું કામ કરવા હાયાલિસિસ કરવામાં આવે છે. અને કિડનીને બદલવામાં પણ આવે છે.

આજનું વિજાન કેવળ આટહું જ જણે છે. ચોક્કસ અને સંપૂર્ણ મૂત્રકાય પ્રણાલી હજુ જાણી શક્યું નથી. અને સંપૂર્ણ જણશે ત્યારે ધ્યાનચ્છુથી મૂત્રસર્જનની વાત કહેનારા આયુર્વેદના મહિંઓની વાતની સાવ નજીબીક હશે.

નેઝોનને ઈજન થાય તો પાણીનો નિકાલ બરાબર થતો નથી. તેથી શરીરમાં પાણી ભરવાથી સોન્ન, જોદર,

ખુરસી, ઇક્સાંમાં પાણી ભરાવું વગેરે રાગો થાય છે. આંખનાં પોપચાં નીચે પાણી ભરાવાથી નહોન અસ્વસ્થું હોવાનો અંદાજ થઈ શકે છે. કિડનીના અન્ય દરદોમાં તાવ તથા મૂત્રનો રંગ વધુ ધંડ થવો વગેરે જોવા જો છે. મૂત્રપરીક્ષણમાં આદખ્યુમીનના ટકા આવે તો પણ કિડની બિમાર હોવાનું અનુમાન કરી શકાય. કિડનીમાં તીવ્ર પીડા થાય તો પ્રાય: પથરી હોવાનું પરીક્ષણ કરાવવું જરૂરી અરું.

નહોનોમાંથી શુદ્ધ થઈને સતત ટપકચા કરતો પેશાગ્નિન્યન્દન કે સાવ (Secretion)ના સિદ્ધાન્તથી કિડનીમાં રેનાલ પદસપીઝમાં એકડું થયા બાદ મૂત્રવાહિનીઓ (યુરેટસ)માં આવે છે. આ મૂત્રનલિકાઓ કિડનીથી શરૂ થઈ મૂત્રાશય (બસ્ટિ-બલેડર) સાથે જોડાયેલી હોય છે. માંસપેશીઓની અનેલી આ બંને નળીઓની લંબાઈ ૧૦ થી માંડી ૧૬ ઇંચ સુધીની હોય છે અને તેની પહોળાઈ ૧/૪ ઇંચ હોય છે. વ્યાન-અપાન વાયુના કાર્યક્રમે આકુંચન લહેર ઉત્પત્ત થવાથી વારંવાર મૂત્ર આ નળી દ્વારા મૂત્રાશય તરફ રવાના થયા કરે છે. અને નીચે આવેલું મૂત્રાશયમાં એકનિત થાય છે.

મૂત્રાશય (બલેડર-Badder) પેટમાં સાવ નીચે નાલિ નીચે રહેલું છે. તે આમારાથી જેમ મજબૂત અને સ્થિતિ સ્થાપક મરીક (કોથળી) હોવાથી કારણવશાત મૂત્ર વધુ ભરાય તો તેઠે નાલિ સુધી ઝૂલી જય છે અને સામાન્યતઃ તેમાં ૨૦૦ થી ૩૦૦ મિ. લિ. મૂત્ર એકનિત થવાને અદસે

૧ કિટર જેટલું પણ સમાવી રીડે છે. પુરુષમાં આ મૂત્રાશય પેકુની પાછળ અને ગુદાની વ્યયમાં હોય છે. સ્વીઓમાં તે ગલ્ભાશયની પાછળ હોય છે.

એક જ્ઞાસ જેટલું એટલે કે ૨૦૦ થી ૩૦૦ મિ. લિ. જેટલું મૂત્ર એટનિં થતાં જાનતાં તુ મગજના મૂત્રનિયંત્રણ કેન્દ્રમાં સુંદરેશો. પહેંચતાં જ આશાંકાં દ્વારા તેના ઉત્સર્ગની આશા થવાથી નાનકડા માંસલ વાદવ કે જેને સંક્રાયક દ્વારા કહેવામાં આવે છે. તેનું સંક્રોચ અપાત અને વ્યાન વાયુ દ્વારા થવાથી આપણી ઘર્છાને આધીન સંક્રાયક દ્વારા ખુલ્લી જતાં મૂત્ર મૂત્રનળી (યુરેથ્રા-Urethra)માં આવી બહાર ઈંકાય છે. સામાન્યતઃ મનનિયમન (ધૈર્ય) દ્વારા આડ-દસ કલાક સુધી મૂત્રને વેગ રોકી શકાય છે. (જે કે મૂત્રનો વેગ કારણ સિવાય રોકવો હિતાવહ નથી. ‘ન વેગાન ધારયેત ધીમાન પુરુષિશાળી વ્યક્તિએ કચારેય વેગો ન રોકવા.’)

મૂત્રનળીનું નિયંત્રણ સંક્રાયક ગોળાકાર વિદ્વારા સખત બંધ રહેતું હોવા છતાં લય, ચિંતા, અદ્ભુતતા કે ગ્રેસ્ટેટ (પૌરુષગ્રનિથ) જેવા રોગોમાં તેના ઉપર નિયંત્રણ રહી શકતું નથી. શાયામૂત્ર (પથારીમાં પેશાબ)ના રોગમાં પણ તેવું બને છે. સ્વીઓમાં મૂત્રનળીની લંબાઈ ફુલ. એકાદ ઈંચની હોય છે જ્યારે પુરુષમાં તે લંબાઈ લિંગ જેટલી એટલે કે ચારથી માંડીને આડ ઈંચ જેટલી હોય છે. દિવસ દરમિયાન મૂત્રોત્સર્ગમાં સામાન્ય રીતે કિટરથી હોઢ કિટર જેટલું મૂત્ર બહાર આવે છે.

'ખૂફ્ફ નિધિંકુ રતનાકર' (મૂત્ર પરીક્ષા-૨૩) નામના આયુર્વેદીય અન્થમાં મૂત્રમાત્રાનો ક્લોઝ આ પ્રમાણે છે :

અહોરાત્રેણ વિસ્તૃજેત સ્વસ્થો મૂત્રમનાવિલમ્  
અપાણુક્રોચ્ય તરલાં પલાનામણસમિમિતમ્ ॥  
બાહુદ્યેન જલાં તત્ત્વ કર્ણિનાં સ્વલ્પમેવ હિ ।  
દૃથ્યતે પલમૂત્રેનું ચતુર્ગંભડવસ્થિતિ ॥

સ્વસ્થ માનવ રાત-દિવસમાં લગભગ ૮ પલ એટલે કે ૩૨ તોલા (૩૦૦ થી ૪૦૦ મિ. લિ.) જેટલા મૂત્રનો ત્યાંગં કરે છે. આ મૂત્ર નિર્મણ, ધોળું કે ઝીકું ન હોય તેવું અને તરલ (ઉદૂનશીલ) હોય છે. આ મૂત્રમાં જલતત્ત્વની બહુલતા હોય છે. તેમાં કર્ણિન તરફનું પ્રમાણું ખૂબ જ થોડું હોય છે. એક પલ મૂત્રમાં ડેવળ ચાર ચણોઠીલાર (૪ રતી અથવા ૧/૨ ગ્રામ) જ કર્ણિન પદાર્થ (ક્ષાર વગેરે) હોય છે.



૪

## શિવામણુમાં સતત પરિવર્તન

તહુરસ્ત વ્યક્તિનું સ્વસ્થ શિવામણુ પાણી નેવું  
સ્વચ્છ, ડિંચિત પીળું, ડિંચિત ખારું અને છડવું હોય  
છે. તેમાં સહન થઈ શકે તેવી અદ્યપ્રમાણુમાં ઉગ્ર ગંધ  
હોય છે.

પરંતુ સ્વસ્થ વ્યક્તિના શિવામણુમાં પણ સતત પરિ-  
વર્તન થયા કરતું હોય છે. અસ્વસ્થ વ્યક્તિના શિવામણુમાં  
પરિવર્તન હોય તે તો સત્તાલાભિક છે. તેના ઉપર આહાર,  
વિહાર, ઝડપુણો, સમય, પ્રકૃતિ, રોગો, ઔષધો, વાતાવરણ,  
પ્રદેશ, માનસિક સ્થિતિ વગેરેની અસર થયા વિના રહેતી  
ન હોવાથી તેના રંગ, ગંધ, ગુણ, ધકૃતા વગેરેમાં હમેશાં  
થોડુંધણું પરિવર્તન તો આવ્યા વિના રહેતું નથી. ડાઈચ  
વ્યક્તિનું શિવામણુ કચારેય એક સરખું હોઈ ન શકે.

### ૦ શિવામણુ પર આહારની અસર

#### (૧) દૂધ

દૂધ મધુર, શીતળ, સૌભય, સાર્વિક, શીતળીય અને  
અધુર વિપાકવાળું હોવાથી ડેવળ દૂધ ઉપર રહેવામાં આવે,  
તેનું પ્રમાણ વધુ લેવામાં આવે ત્યારે મૂત્ર સ્વાદ-રંગ  
વિનાનું અને સૌભય હોય છે. ધાવળાં કે દૂધપીતાં બાળકોનું

મૂત્ર પણ એ કારણે ગરમ નથી ગણાતું અને ડાઈન પણ આપી શકાય છે.

ગરમ ઝડપ, ગરમ પ્રહેશ, ગરમીનો રોગ અને ગરમ પ્રકૃતિમાં દુઃખાહાર સા�ે શિવામ્બુપાન વધુ હિતાવહ થઈ શકે. જે કે, ડેટલાક વિદ્યાનો અહિંસા, નૈતિકતા વગેરેના સંદર્ભમાં દૂધ લેવાની ના કહે છે તે વિચારણીય છે. પણ પ્રોટીનના સંદર્ભમાં દૂધ પીવાની ના કહે છે તે યોગ્ય નથી. કારણ કે શિવામ્બુકદ્વારા (ક્ષેત્ર ૩૮-૩૯)માં તો દુઃખાહારી રહીને શિવામ્બુસેવન કરવામાં આવે તો સર્વ રોગો મટ છે તેવું કહેવાયું છે.

## (૨) જલીય દ્રવ્યો

મૂત્રનું સર્જન જળતરવમાંથી થતું હોવાથી પાણી કેટલું પીવામાં આવે છે કે આહારમાં જલીય દ્રવ્યો - દૂધ, છાશ, દાળ, કદ્દી, ચા, ડેઝી, શેરડીનો રસ, ફોળનો રસ, ઠંડાં પીણાં વગેરે ડેટલા પ્રમાણમાં લેવાય છે તેના પ્રમાણમાં શિવામ્બુનું સર્જન થાય છે. (‘સમાને વૃદ્ધિ-સરખું સરખાને વધારે’ તે આયુર્વેદીય સિદ્ધાન્ત અનુસાર જળતરવનું સમ્યગ્ માત્રામાં સેવન કરતાં રહેવું તે અતિ જરૂરી છે. એ માટે ‘મુહૂર મુહૂર વારિ પિષેત અભૂરિ-વાર વાર થોડું પાણી પીતાં રહેવું’ તેવું કહ્યું છે. કારણ કે જળનો એક પર્યાય જવન છે. ‘ભોજનાન્તે પિષેત તકમ્-ધ્યોારે ભોજના અંતે એટલે કે સાંજના વાળુમાં છેલ્સે દૂધ પીવું.’ (નિરાન્તે

પિષેત વારિ—રાત્રિના અંતમાં (મળસ્કે ઉષઃપાન રૂપે) પાણીની  
પીવું? એ બધાં આયુવેદીય સૂત્રો શરીરને આવશ્યક છતાં  
વિવેકપૂર્વક જળતરવ પૂરું પાડવા માટે છે.

અહીં એ પણ યાદ રાખવા જેવું છે કે અતિષય વધુ  
પાણી પીવું તે પણ છચ્છનીય નથી. કારણ કે તેથી મંદાદિન  
થાય છે અને ‘સવે’ રોગાડપિ જથુંતે મંદેંતૌ—બધાં  
રોગોનું કારણ મંદાદિન છે.’ અને મંદાદિન થવાનાં મુખ્ય  
કારણોમાં આયુવેદ ‘અત્ય યુપાનાત. ખૂબ પાણી પીવાથી  
મંદાદિન થાય છે.’ તેવું કહેલ છે.

આડા, ભલટી, ડોલેરા વગેરે મુખ્યત્વે મંદાદિનથી થતા  
રોગોમાં જળતરવ ચાલ્યું જવાથી (ડી હાઇડ્રોજન થવાથી)  
તે તાત્કાલિક આપવું અતિ જરૂરી હોવાથી મંદાદિન ન  
થાય તેવું જળતરવ પૂરું પાડવા પાણીને બદલે લીંઝુનું  
સરબત, નાળિયેરનું પાણી, છાશ વગેરે મંદાદિન ન કરે  
તેવાં જલીય દ્રવ્યો આપવાનું આયુવેદમાં વિધાન છે.  
જેમણે, (‘વિષુચિકાયાં ન ચ નિષ્ફૂનીરમ्।—ડોલેરામાં લીંઝુના  
રસ જેવું એક્ઝ્ય ઔષધ નથી.’ ‘ન તકૃતુલ્ય ગ્રહણીવિકારે  
—ગ્રહણી (સંગ્રહણી) રોગ મટાડવા માટે છાશ જેવું એક્ઝ્ય  
ઔષધ નથી.’)

માંદગી કે ડોઈ કારણસર ઉપનાસ ચાલુ હોય ત્યારે  
કે માંદગીમાં અરુચિને કારણે ઘોરાક કે ડોઈ જલીય દ્રવ્યો  
કે પાણી લઈ શકાતાં ન હોય ત્યારે તે વ્યક્તિના શરીર-  
માંથી મૂત્રરૂપે ૫૦૦ થી ૬૦૦ મિ. લિ. જેઠલું શિવામ્બુ

અહાર આવતું હોવાથી શરીરના અતિ આવસ્થક (રિઝવ್) જીથામાંથી જળતરવનો ધટાડો થવાથી સરવાળે લોહીમાંથી જળતરવ ચૂસાવાથી અને તે ૨૦ ટકા નેટલું ચૂસાય જય તો ડિ હાઇડ્રેશન થતાં જીવલેણું પણ નીવડી રહે. તેથી ઉપવાસ કે લંઘન વખતે પણ સતત થોડું થોડું જળ આપવું જરૂરી છે પણ તે મંદાભિમાં વધારો ન કરે તેવું એટલે કે ઉકાળાને ઠારેલું જ આપવું જેઈએ.

### (૩) ભસાલા

મૂત્ર પોતે ઉષુ-તીક્ષ્ણ એટલે કે ગરમ પ્રકૃતિવાળું હોવાથી ગરમ ભસાલા વધુ લેવાથી મૂત્રમાં ઉષુતા, તીક્ષ્ણતા, ખારાશ, ક્ષારીયતા અને તીખાશ વધવાથી તે વધુ પીળું લાલ, તીક્ષ્ણ ગંધવાળું અને ગરમ બને છે. તેથી પિતપ્રકૃતિ, પિતનાં દર્દી, ગરમ પ્રદેશ વગેરેમાં શિવા-ભૂસેવન કરનારે મરચાં, રાઈ, મરી વગેરે ગરમ ભસાલા છોડી હેવા અથવા ખૂબ જ થોડા લેવા. ઠંડા ભસાલા નેવા કે જરૂર ધાળા, લવિંગ, તમાલપત્ર વગેરેમાં તેવા ગુણ ન હોવાથી છુટથી લઈ શકાય.

### (૪) ફળો

ફળો પ્રાયઃ વળું પ્રકારના હોય છે. મીડાં, ખાટાં-મીડાં, અને ખાટાં. મીડાં ફળો પ્રાયઃ શીતળીય (કંડાં) અને મધુર વિપાકવાળા (પચે ત્યારે મધુર થનારાં) અને સૌભ્ય હોવાથી તે ગરમ પડતાં નથી અને તેના સેવન દરમિયાન મૂત્રમાં ઉષુતા-તીક્ષ્ણતાનું ગ્રમાળ ધણું ઓશું હોય છે. તે

ખારું, તીખું ડેક્સારીય પણ એછું હોય છે. જિલ્લાનું રસમાં મધુર પણ હોય છે. જ્યારે ખાટી ડેરી, ટામેટો, લીંબુ, ફણુસ, ખાટાં-સફેજન, ખાટાં બોર વગેરે (આમળાં, દાડમ મધુર વિપાક અને શાતવીય્ચવાળા હોવાથી અપવાદ છે.) ગરમ હોવાથી મૂત્ર ઉણું, તીખું, ખારું, ક્ષારીય હોવાથી તે વધુ ગરમ પડે છે. ખટમીઠાં ફોથી મૂત્ર મધ્યમ ગુણવાળું હોય છે.

#### (૫) મીઠું

મીઠું જેમ એછું ખાવામાં આવે તેમ મૂત્રમાં ગંધ એછી આવે છે ને ખારાશનું પ્રમાણ ધરે છે. જેઠે દરિયાઈ મીઠા કરતાં સિંધવના ગુણ સાવ જિલ્લા હોવાથી તે ખાવામાં આવે તો ગંધ, સ્વાદ, રંગ, ગુણ બધી રીતે અનુકૂળ બને છે.

#### (૬) માંસાહાર

માંસ વધુ ખાનારા લોડેના મૂત્રમાં વધુ પ્રોટીનને કારણે યુરિયા, નાઈટ્રોજનયુક્ત વયથ પદાર્થ, યુરિક એસિડ, ચન્દોલસ એમેનિયા તેમજ અન્ય વિષયુક્ત ખરાખીનું પ્રમાણ વધી જતું હોવાથી માંસાહારી લોડેના મૂત્રમાં જથ્ર ગંધ હોય છે. તે કારણે મૂત્રમાં અનુકૂળતા પણ વધારે હોય છે. યુરિયા જેમ વધુ બને તેમ કિડનીને વધુ કામ કરવું પડતું હોવાથી તેવા લોડેમાં કિડની ઇર્ઝલના કેસ વધુ થવા સંભવ છે. માંસાહારમાં રહેલ પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન પચે છે, યારે તેમાંથી એમાઈના એસિડ.

અને છે. જેમાંને એમોનિયા અને લોહીમાંના કાર્બન ડાયોક્સાઈડ એકત્ર થવાથી બુકૃતમાં યુરિયા પેદા થાય છે. જેના ઉત્પાદનનું પ્રમાણું હિવ્સ દરમિયાન ૪૦ ગ્રામ જેટસું હોય છે, જેનો મૂત્રોત્સર્જ દ્વારા બરાબર નિઠાલ ન થાય તો લોહીમાં જેર ભળવાની શક્યતા છે.

જે પ્રદેશમાં અને જ્યારે મુસ્લિમ ધર્મની સ્થાપના થઈ ર્યારે ર્યાં માંસાહાર મુખ્ય ઝારાક હોવાથી મુસ્લિમ ધર્મમાં મૂત્રસેવન ઈચ્છનીય માત્રવામાં આવેલ નથી તે આ કારણે હોવાનું અનુમાન કરી શકાય.

#### (૬) દાડ

દાડ પીનાર વ્યક્તિના નેકોનો નબળા થઈ જતા હોવાથી પાણી શોષી ન શકવાથી તેમને બહુમૂત્રના (વારંવાર પેશાબ કરવા જવાનો રોગ)નું દરદ લાગ્યું પડવા સંભવ છે.

#### (૭) વ્યસનો

દાડ, તાડી, ચા, ખીડી, કોણી, ડોકો, અફીણુ, ગાંજો અને નવા વૃપરાતાં વ્યસનકારક જનતનીતના ઝૂઝુ લેવાથી મૂત્રમાં વિકૃતિ આવ્યા વિના રહેતી નથી. કયારેક તો મારક પ્રકારનાં વિષ પેદા થવા સંભવ છે.

#### (૮) શાકાહાર

શાકાહારી લોડેનું મૂત્ર ક્ષારીય હોય છે. તેથી શિવાન્ધુસેવન સાથે શાકાહાર વધુ અનુકૂળ ગંગાયેલ છે છતાં આયુર્વેદ કહેલ અપર્યુ શાકો, તેમજ શિવાન્ધુ-

કદ્મે કહેલ પત્રશાકો (ભાજીઓ) અને પુણ્યપત્રશાકો (ફલાવર જેવાં) અછિતકર માનવામાં આવ્યાં છે.

ભોજન બાદ, શરીરમાં જગતરવ જવાથી અને મૂત્ર તથા વાયુનું અનુલોભન થવાથી મૂત્રોત્પત્તિનું પ્રમાણું વધતું હોય છે.

આ રીતે શિવામ્બુ ઉપર આહારની ઓછી કે વધુ અસર થયા વિના રહેતી નથી. શ્રી આર્મસ્ટ્રોંગે જોંધ્યું છે કે પેશાખના અમ્લ ક્ષારોમાં યુરિયા (એન)નું પ્રમાણું સ્વરૂપ અવસ્થામાં ૬૮૨ યુનિટ ગણાયું છે. ૫૨ંઘ આહારનું પરિવર્તન થતાં વધીને તે ૧૮૨૮ યુનિટ અને ધરીને ૨૬૮ યુનિટ સુધી જોવા મળે છે. આ બંને અવસ્થા રોગોત્પાદક ગણાયેલ છે.

## ૦ શિવામ્બુ પર વિહારની અસર :

આહાર સિવાયનાં બાકીનાં બધાં કાર્યને વિહાર કહેવામાં આવે છે. તેમાં ડેવળ શારીરિક જ નહીં જાન-સિક કાર્યેના પણ સમાવેશ કરવામાં આવેલ છે. તેથી આહારની જેમ ડેઈપણ કાર્ય વધુ પ્રમાણમાં કરવામાં આવે તો તેની અસર શિવામ્બુના ગુણ, રંગ, ગંધ, સ્વાદ કે માત્રા ઉપર પડ્યા વિના રહેતી નથી. જેમણે, જાંધ વધુ લેવામાં આવે, મોડા જિઠવામાં આવે કે દિવસે સૂવામાં આવે અથવા વધુ આરામ કરવામાં આવે ત્યારે મૂત્રનું પ્રમાણું ધટે છે અને તેમાં કદ્મ તેમજ તમસના ગુણ ઉમેરાય છે. અતિ કાર્ય, અતિ કસરત કે અતિ વ્યાયામ

કરવામાં આવે તો પસીનો વધુ થતો હોવાથી મૂત્રસ્થાવનું પ્રમાણ અને માત્રા ધટે છે. અને મૂત્રમાં વાયુ-પિતના ગુણો ઉમેરાય છે. કોધની અવસ્થામાં મૂત્ર વિષાક્તા થવાનો સંભવ છે અને તેમાં પિત અને રજેગુણની વૃદ્ધિ થવાથી રંગ પીળો કે લાલ; સ્વાદ ખારો, ખાટો કે વધુ તીઝો અને છે. તે ગરમ પડે છે. ચિંતા, શોક-ભયમાં વાયુ વધવાથી મૂત્રસ્થાવ વિષમ અની જતાં કાંતો સ્થાવ વધી જય છે, કાંતો ધરી જય છે અને તેમાં વાયુવધ્યક અંશો-ગુળોમાં વધારો થાય છે. સંતાપ, કોધ, ભય કે ક્ષોલની અવસ્થામાં મૂત્રની માત્રા ધટે છે. ઉદ્દીગન થયેલ વ્યક્તિના મૂત્રસાં એડ્રિનલનો સ્થાવ અને અધિક ઉતેજનાની અવસ્થામાં થાઈરોઈડ હોમેન્સનો સ્થાવ વધી જય છે તેવું વૈજ્ઞાનિકોએ સાચિત કરેલું છે. ‘અમરોલી’ નામના પુસ્તકમાં યોગ-પારંગત એસોપથિક ડોક્ટરોએ જગ્ણાંયું છે કે ‘ચેતનાની ઉચ્ચ અવસ્થા – આત્મજ્ઞાનની અવસ્થામાં શરીરમાં નવાં રસાયનોનો સ્થાવ થતો હોય છે. તેથી ઉચ્ચ ડેટિના મહાપુરુષો કે ગુરુનું શિવામ્બુ પ્રસાદીઓ આપવામાં કે સેવામાં આવે છે.’

## ૦ શિવામ્બુ પર ઋતુ-કાળની અસર :

ગરમીમાં (ગ્રીષ્મ-શરદીના તુલુમાં) પસીનો વધવાથી મૂત્રનું પ્રમાણ ધટે છે. અને તેમાં ક્ષારીયતા, તીખાશ, ખારાશ, તીક્ષ્ણતા વધવાથી વધુ ગરમ પડે છે. તેથી પિતપ્રકૃતિ, પિતના રોગો અને ગરમ પ્રદેશમાં, ઉણુંઝતુમાં કેટલાકને

શિવામ્બુ પ્રયોગ માઝક નથી આવતો. તેનાથી ઊલદું, કંડ  
અને વાયુના રોગોમાં વધુ માઝક આવે છે.

ઠંડીમાં (હેમંત-શિશિર-વર્ષામાં) પસીનાનું પ્રમાણું  
ધર્ટવાથી મૂત્રોત્સર્જન વધુ થાય છે. રક્તવાહિનીઓનું  
સંક્રાચન પણ તેમાં કારણભૂત બને છે. મૂત્રપિંડની ધમની  
પહોળી થવાથી અને મૂત્રને પ્રેરનારા સમાન-વ્યાન વાયુ  
વધતા હોય છે કે વિકૃત થતા હોય છે. આ જ કારણે  
ઠંડીમાં તે ભીતાં સ્થળે રહેવાથી વ્યાનવાયુ પર અસર  
થવાને કારણે મૂત્રાશથની ભાંસપેશીઓનું સંક્રાચન થવાથી  
અને પસીના ન થવાથી મૂત્રાશથ પૂર્ણ લયું ન હોય તો  
પણ મૂત્રોત્સર્જનું પ્રમાણું વધે છે. સ્તનાન કરતી વખતે,  
માથા પર વરસાદ કે ઠંડુ પાણી પડવાથી મોટા ભાગના  
દ્વારાને મૂત્રત્યાગની ઈચ્છા થઈ આવે છે.

ઠંડી કાતુમાં શિવામ્બુ મધુર, કંડવું અને સૌમ્ય.  
હોવાની વધુ સંભાવના છે. તેથી પિત્રવાળા માટે ઠંડી  
કાતુમાં શિવામ્બુપ્રયોગ કરવો વધુ માઝક આવે છે.

દિવસ કરતાં રાત્રે મૂત્રનું પ્રમાણું ધરીને અધું કુ  
ચોથા ભાગનું પણ જય છે. દિવસ કરતાં રાતનું શિવામ્બુ  
એછું ગરમ હોવા સંભવ છે. વહેલી સવારે શિવામ્બુનું  
સેવન કરવાના આગ્રહ કે નિયમ પાછળ તે એછું ગરમ.  
હોવાથી લગભગ ત્રિદ્વારશામક હોવાનું કારણ પણ ખરું.

અચ્યપણુમાં દૂધ તેમ જ મધુર આહાર વધુ દેવાતે  
હોવ થી, વધુ ઊંઘ થતી હોવાથી અને પ્રાય: કંડપ્રવૃત્તિ.

હોવાથી શિવામ્બુ સૌભય હોય છે અને લગભગ ત્રિહોષિ-  
શાસ્ક હોવાથી અન્ય વ્યક્તિ પણ તેનું સેવન કરે તો  
અનુકૂળ થાય તેવું હોય છે. યૌવનમાં પ્રાયઃ પિતા પ્રકૃતિને  
કારણે, ખાડું, તીખું, ખારું, અને ગરમ વધુ ખવાતું  
હોવાને કારણે શિવામ્બુમાં ઉણુતાનું પ્રમાણ વધુ હોય  
છે, વધુ ધારોણું પણ હોય છે. તો ધડપણમાં ઉણુતાનું  
પ્રમાણ ધરે છે. યુવાનોના શિવામ્બુ જેટલું શક્તિપ્રદ  
શિવામ્બુ ધરડા લોકાનું નથી હોતું, તેમાં વાયુને કારણે  
ઝક્ષતા, તુરાશ અને કડવાશ વધે છે.

## ૦ શિવામ્બુ પર રોગોની અસર :

શિવામ્બુ સુવસ્થ અવસ્થામાં હોય તેવું અસુવસ્થ  
અવસ્થામાં કદાપિ રહી શકતું નથી. પ્રત્યેક રોગની અવ-  
સ્થામાં તેના રંગ, શુણ, સ્વાદ, ગંધ, માત્રામાં પરિવર્તન  
થાય છે. જેમણે, જવરની અવસ્થાને શિવામ્બુનું પ્રમાણ  
ધરે છે અને તેના રંગ રતાશ પડતો જોવા મળે છે.  
કુમળામાં શિવામ્બુનો કુલર હેણદર જોવો પીળો હોય છે.  
તો કિંની કે જલેડરના રોગોમાં રંગ ફૂધિયો લાલ જોવા  
મળે છે.

ને કે રોગો વિષયકની વિચારણામાં વાયુ, પિતા, કુકુ  
અનુસાર મુખ્ય ત્રણ વિભાગ પાડવામાં આવે તો વધુ  
સરળતાથી સમજય તેમ છે.

૧. વાયુના રોગોમાં : વાયુના રોગોમાં શિવામ્બુનો  
રંગ થાડો કાળાશ પડતો હોય છે. સ્પર્શમાં ધારોણું

શિવાન્ધુ વધુ ગરમ નથી હોતું. તેમાં સરખામણીમાં ઇક્ષ ચુણુનું પ્રમાણું વધુ જેવા ભણે છે. રસમાં તેમાં તૂરાશ અને કંડવાશનું પ્રમાણું વધારે હોય છે. મૂત્રત્યાગ વધતે તેમાં ઝીણું પણ વધુ વળે છે. ગંધમાં તીક્ષ્ણતાનું પ્રમાણું ઓછું હોય છે.

**૨. પિતના રોગોમાં :** પિતના રોગોમાં શિવાન્ધુનો રંગ લાલ, પીળો કે ફેરારી હોય છે. સ્પર્શમાં ધારોણું શિવાન્ધુ વધુ ગરમ હોય છે. તેમાં ઉણુતા, તીક્ષ્ણતા વગેરે ગરમ ગુણોનું પ્રમાણું વધુ જેવામાં આવે છે. રસોમાં તેમાં ખારાશ, તીખાશ અને ખટાશનું પ્રમાણું વધારે હોય છે. તેની ગંધ વધુ તીક્ષ્ણ હોય છે.

**૩. કંકના રોગો :** કંકના રોગોમાં સરૈદ પાણી જેવું અથવા પાંડુ (આજું પીળું) હોય છે. ધારોણું શિવાન્ધુ ગરમ નથી હોતું, કચારેક ઠંકું પણ હોય છે. તેમાં તીક્ષ્ણતા, ઉણુતાને બદલે કવચિત સૌભ્યતા જેવા ભણે છે. તેમાં મહુરતા અને ખારાશ સવિશેષ હોય છે. તેની ગંધ બાળકના મૂત્રની પેટે તીવ્ર નથી હોતી.

## ૦ શિવાન્ધુ પર ઔષ્ઠદોની અસર :

ચરક સંહિતામાં ખાસ ગુણ અને કાર્ય શક્તિ ઉપરથી દસ દસ ઔષ્ઠદોની દરોમાનીનું વર્ણિત હોય છે. શિવાન્ધુને સ્પર્શાત્મી નણું દરોમાની (દસદસ ઔષ્ઠદોનું જૂથ) આ પ્રમાણે છે:

૧૦. મૂત્ર-વિરેચનીય ઔષધોઃ : મૂત્રલ અથવા મૂત્રનો રેચ કરનારાં ૧૦ ઔષધોમાંથી આજના યુગમાં ભળાઈ રહે અને પ્રયુક્તિ હોય તેવાં જોખરું, પાષાણલેદ, દલ્લ (દાલડા) અને ધાખાજરિયું છે. પાષાણલેદ પથરીનું ઉત્તમ ઔષધ છે તો જોખરું મૂત્રકુચ્છ (જિનવા), મૂત્રાધાતુ (મૂત્ર ન બનવું), પથરી, બસ્તિવાત વગેરે મૂત્રમાર્ગના લગભગ તમામ રોગોમાં કામયાબ છે.

આ ઉપરાંત એકૌષધમાં સાટોડી (પુનર્વા), શિલા-જિત, હુર્ડે, આમળાં, જવ, નાળિયેરનું પાણી, કાકડીનાંખી, મૂળા, શેરડીનો રસ, છાશ, દુધ, કળથી વગેરે પણ મૂત્રલ છે. તૈયાર યોગોમાં જવખાર, પુનર્વાહિ કાઢા, જોકુરાહિ ચૂણું, જોકુર ગૂગળ, પુનર્વા ગૂગળ, ચંદ્રપ્રલાલી, પુનર્વા ધનવટી, પુનર્વા ચૂણું, ત્રિકુળા ચૂણું, હરીતકચાહિ કવાથ, અંશમરીહર કવાય વગેરે વપરાય છે.

૨. મૂત્ર-સંબ્રહણીય ઔષધોઃ : આ દશમાનિમાં મૂત્રને રોકનારાં કે ઓછું લાવનારાં ઔષધોનું વળ્ણનું છે. જેમાંનાં મેટે ભાગે આજે પણ પ્રાપ્ત અને પ્રયુક્તિ છે. જેમાં છે જંબુ, આંખો, વડ, પારસ્પીપળો, ઉમરો, પીપળો, પીપર (લક્ષ), ભીલામો અને સફેદ ખેર.

આ બધાં દર્શયો તૂરો રસ અને ગ્રાહી ગુળને કારણે મૂત્રનું ઉત્પાદન ઘટાડી નાખે છે. તેથી શિવામૃષુસેવન કરનારે જંબુ ખાવા ઈચ્છનીય નથી. બહુમૂત્રતાના રોગમાં ઔષધરૂપે લઈ શકે.

૩. મૂત્ર-વિરંજનીય ઔષધોઃ : આવાં ઔષધોમાં ભૂત્રનો રંગ દૂર કરવાના તથા વિકૃતિ દૂર કરવાના ગુણ હોય છે. જેમાંનાં પ્રયત્નિત ઔષધોમાં છે બધી જ જતનાં ક્રમળ, ધઉંલા અને જેડીમધ. જેને શિવામ્બુના રંગની સૂગ હોય તેણે દૂધ સાથે જેડીમધ ચૂંગું લેવાનું રાખવું જેઈએ.

શિવામ્બુ પરિવર્તનતી એ વાત જગુવા જેવી એ છે કુ, તેની સાન્દ્રતા (ધર્તા-કોન્સ્ટ્રેશન) જેમ વધે તેમ રંગ વધું પીળો બને છે. અને શિવામ્બુના શરીરમાં થતી વધું રક્ત, રક્તવાહિનીઓ તથા શરીરનાં આંતરિક અવયવોને સુવ્યવસ્થિત રાખે છે.



પુ

## આયુર્વેદમાં શિવાન્ધુ

આયુર્વેદ એ માનવજીતિનું પ્રાચીનતમ આરોગ્યવિજ્ઞાન છે. જેનાં મૂળ છે ઠેડ ઋગ્વેદ અને અથર્વેદમાં. રામાયણ, મહાભારત, પુરાણો!, ઉપનિષદો વગેરેમાં પણ આયુર્વેદનો સારા પ્રમાણમાં ઉલ્લેખ છે. જે કે, આયુર્વેદનું એક અલગ વિષય તરીકે વ્યવસ્થિત સર્જન થયું છે. સ. પૂ. એકાદ હજન્નર વષ્ટ આસપાસ લખાયેલી કાશ્યપ સંહિતા, અનિતવેશ સંહિતા (ચર્ક સંહિતા) અને સુશ્રુત સંહિતાના સમયમાં. આ સંહિતાઓમાં આયુર્વેદના સિદ્ધાંતો, આરોગ્યના નિયમો, આહાર-વિહાર, રોગોની સારવાર, ઔષધો વગેરે લગભગ તમામે તમામ બાધ્યતાનું સંછેરન કરવામાં આવેલ છે. સંહિતાનો અથ છે સંચય કરેલ આધારભૂત ગ્રંથ. તે યુગ સુધીમાં આયુર્વેદ ક્ષેત્ર અને કવિધ જ્ઞાન ઉપક્ષય હતું તે બધું પ્રાય: તેમાં સંહિત કરવામાં આવ્યું. એ યુગની ભર્યાદી એ હતી કે આજના જે ટકી સુખસર્ગવડ ત્યારે ન હતી, ત્યારી જીવન જીવતા એ યુગના તપસ્વીઓ, ઋષિઓ, મહાવૈદ્યો વનસ્પાતિ, શાન્યુ-જીવનમાં કે એકાંતમાં રહેતા. ત્યારે આજના જેવી વીજળીની સરગવડ ન હતી; પેત, બોલપેત કે ટાઈપરાઈટરાની વ્યવસ્થા

નહોતી, લખવા કાગળ ન હતા, બેસવા ટેબલ-ખુરશી ન હતા. પુસ્તક છાપવાની ફોર્મ વ્યવસ્થા ન હતી. નહોતાં ટેપરેક્ટાડ'ર કે નહોતી ડેસેટ, આમાંનું કશું જ નહોતું. હાથે તૈયાર કરેલા તાડપત્ર પર હાથે બનાવેલી રાહી અને હાથે જ બનાવેલું પીંછામાંથી, તૈયાર કરેલા કિતા કે કલમોથી લખવાનું હતું. બાઈન્ડની વ્યવસ્થા ન હોવાથી દ્યુટાં પાનાં સાચવવાં પડતાં, પણ એકબે બાબતે તેઓને આજનો સરખામણીમાં સુખ હતું. મેધા, સ્મૃતિ, મનની શાન્તિ, વિદ્યાવ્યાસંગ અને ગાગરમાં સાગર જરવાની સૂત્રાત્મક લાષા. તેથી આયુર્વેદમાં જે ફોર્મ વિષમ ઉપર કહેવામાં આવેલ છે તે ટૂંકમાં કહેવાયેલું છે. જેના એક એક સૂત્ર ઉપર આપણે ધારીએ તો એક એક પુસ્તક લખી શકીએ. એક જ સૂત્રને જીવનમાં અનુભવવા દર્શાવીએ તો આખું ને આખું જીવતર ખતમ થઈ જય.

શિવારણુ બાબતે પણ આયુર્વેદમાં આવું જ છે. તેની તમામ સંહિતા અને તમામ નિધિંકુ (દ્વયોના ગુણ-દોષનું વાર્ણન કરતો અન્ય)માં પ્રાય: નરમૂત્ર અથવા માનવમૂત્રના ગુણનું આવુસ્યક સંક્ષિપ્ત-સૂત્રાત્મક વાર્ણન છે. કેવળ માનવમૂત્ર જ નહીં પણ પાળેલાં પ્રાણી ગાય, બકરી, હાથી, ઘોડો, જાંટ વગેરેના મૂત્રનું પણ ધર્ણી વિગતે વાર્ણન છે (જેના વિષે લવિષ્યમાં અલગ પુસ્તક તૈયાર કરવાની જારી ધારણા છે.) તે વાંચતાં લાગે છે કે એક બુગમાં આયુર્વેદ મૂત્રચિકિત્સાક્ષેત્રે ખૂબ જ ધ્યાન દઈને, લાંબો ગાળો આપીને, સેંકડો વૈધો અને હજરો દરદી દ્વારા

ચોક્કસ નિણુંયો તારંથા હશે. માનવમૂત્ર વિષે પણ ખૂબું  
જ ગહેન અધ્યયન અને અનુભવો થયા હશે. નહીં તો  
તેના રસાયન ગુણ, વિષધન ગુણ, ચમ્રરાગોમાં રાતી અસ  
મટાડવાની વિશેષતા, તેની ઉણુવીયુંતા વગેરે ડેવી રીતે  
નક્કી કરી શકે? તેમજ હારિત સંહિતામાં સગર્ભા અને  
પ્રસૂતા સ્ત્રીના તેમજ સ્ત્રી-પુરુષના બંનેના મૂત્રના અલગ  
ગુણનું વર્ણન શી રીતે કરી શકે?

આપણે ટૂંકમાં આયુર્વેદીય દણિએ શિવામ્બુની  
શાસ્ત્રીયતા તપાસીએ :

## ૦ શિવામ્બુ... ત્રિહોષની દણિએ-

પંચમહાભૂતના ટૂંકા સ્વરૂપે વાયુ-પિત-કક્ષ અને  
આયુર્વેદમાં તાણાવાળાની જેમ વળુયેલ છે. આ વાત-  
પિત-કક્ષ સમ્યગું હોથ ત્યારે શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ  
રહે છે. પણ તે દૂષિત થાથ એટલે કે વિકૃત થાથ, વધે  
કે ધટે ત્યારે શરીરની સ્પત ધાતુઓ (દૂષયો), આશયો,  
અંગો આદિને દૂષિત કરતા હોવાથી તેને દોષ કહે છે.  
કે ત્રણું દોષો ત્રિહોષને નામે અતિ પ્રઘયાત છે.

જેમ આપણા શરીરના બંધારણુમાં ત્રિહોષ છે તેમ  
શિવામ્બુના બંધારણુમાં પણ ત્રિહોષ છે. તે પીવાથી કુ  
લગાડવાથી શરીરસ્થ ત્રિહોષમાં વધધટ કરીને સારું કુ  
માડું પરિણામ લાવતા હોવાથી આપણે શિવામ્બુમાં રહેલા  
ત્રિહોષની વિચારણા કરીએ :

૧. વાયુ : આકાશ અને વાયુ મહાભૂતના ગુણ લગ્ન ભળતા હોવાથી અને આકાશ તરફ પ્રાયઃ પૃથ્વી પર વાયુ જેટલું સહિય ન હોવાથી તેને ગૌણ ગણી અને મળીને 'વાયુ' (વાત) શબ્દ નક્કી કરવામાં આવેલો છે. આ વાયુ લૂણો, ઠંડા, હળવો, ચંચળ, વિષદ, સૂક્ષ્મ વગેરે ગુણવાળો છે. જ્યારે શિવામણુમાં પંચમહાભૂત તો છે જ ગુણ તેમાં અનિન્દ્રિય તરફ હોવાથી વાયુતરખનું પણ તેમાં અનિન્દ્રિય મુખ્યત્વે હોવાથી વાયુતરખનું પ્રમાણ ધણું ઓછું છે. ડેવળ ઇક્ષ ગુણથી જ તેમાં વાયુ વ્યક્ત થાય છે. થોડા પ્રમાણમાં લઘુ ગુણથી. એટલે કે શિવામણુનું બંધારણ લગભગ ૭૦ થી ૮૦ ટકા વાયુના બંધારણથી વિપરીત હોવાથી તે વાયુનું ઔષધ બને છે. વાયુના અંશોના મોટા ભાગના છેદ તે આ રીતે ઉડાડે છે.

—શીત ગુણ : વાયુના શીત ગુણ છે તો શિવામણુમાં ઉણણ. શિવામણુ પિતકારક, અનિન્દ્રિયપ્રધાન અને ઉણણવીએ (ગરમ તાસીરવાળું) હોવાથી તે વાયુના શીત ગુણનો છેદ ઉડાડે છે. વાયુમાં રહેલા આકાશ અને વાયુ બંને તરવે ઠંડાં છે તો તેનાથી જિલ્ડું, મૂત્રમાં રહેલું અનિન્દ્રિયતરખ ગરમ છે તેથી. આ કારણે શિવામણુ શીત ગુણથી ડાપેલા વાયુના રોગોને સવિશેષ મટાડે છે. અંગ ઠંડું પડી જતું હોય, શીતતરખને કારણે રક્તાલિસરણ તંત્ર કે નાડીતંત્રની ગતિ ઓછી થતી હોય ત્યારે શિવામણુપાન અને અજયંગ ઉણણનું આપીને શીતતરખ ધરાડી સમતા લાવે છે.

વાયુના રોગોમાં શિવામણુ ગરમ કરીને ભાલિશ, બુસ્ટિત, નસ્ય, કણૂંપૂરણું, ડોગળા વગેરેમાં વાપરવામાં આવે તો

વધુ અસરકારક ઘનવા સંભવ છે. પીવામાં પુણ ધારોણું શિવામ્બુ અથવા થોડું ગરમ કરીને લેવામાં આવે તે તેનો ઉણું ગુણ વધતાં વાયુના શીત ગુણને જીતવા તે વધુ કામયાચ બની શકે.

શિવામ્બુમાં અહિન મહાભૂત હોવાથી, ખારું અને ક્ષારીય હોવાથી ઉણું છે. અને તેથી આયુર્વેદના તમામ અન્યોએ શિવામ્બુને વાયુનાશક માન્યું છે. એટલે કે વાયુ પ્રકૃતિવાળી વ્યક્તિને, વાયુના એંશી પ્રકારના રોગોને અને વાયુનું પ્રમાણું શરીર-મનમાં વધતું હોવાથી વૃદ્ધોને, તેમજ વાયુની કાંતુ વર્ધા-શિશિર વગેરેમાં વધુ માઝક આવતું હોવાથી તેમણે તેનો નિઃસંક્રાય અને નિભ્યતાથી આંતર-ભાષ્ય ઉપયોગ કરવો જોઈએ.

૨. પિતા : ૫ંચમહાભૂતમાંથી ડેવળ અહિન તરવ (સ્ફુર્ત તરવ) જ ઉણું છે. જ્યારે શિવામ્બુમાં અહિન તરવ સવિશેષ હોવાથી તે પિતકારક છે. તેનામાં રહેલું જળ તરવ સૌમ્ય હોવાથી તેની પિતકારકતાના પ્રમાણને થોડું ધરાડે છે. શિવામ્બુ જેમ ૨ંગ, સ્વાદ, ગંધમાં પાણીની નજીક તેમ તેમાં ઉણુંતા એછી. શિવામ્બુની સરવાળે તાસીર ઉણું (ઉણું વીય) હોવાથી, અહિનતરવપ્રધાન ખારું, તીખું, ઉણું, તીકણ અને ક્ષારીય હોવાથી, કંકું, વિપાકી (પચે ત્યારે તીખું) હોવાથી તે પિતકારક છે. આ કારણે શિવામ્બુ ઉણું પ્રદેશ, જુઓણું કાંતુ, પિતપ્રકૃતિ, ચૌવન, રક્તસાર કે મેદસાર (જ શરીરમાં રક્ત વધારે

હોય કે મેદ વધારે હોય તેવા બંધારણ વાળી વ્યક્તિ) કે ગરમીના રોગોમાં ટેટલીકવાર માઝક નથી આવતું કે પ્રતિકૂળ પણ પડે છે. તેથી જ્યાં જ્યાં પિતનાં લક્ષણો જણાય ત્યાં શિવામ્બુનો પ્રયોગ કરતાં પહેલાં વિચારવું જરૂરી છે. દૂધ, મીઠાં ઇણો, મીઠાઈ, ખાંડ, ઘી, કાળી દ્રાક્ષ, પરવળ, દૂધી, તૂરિયાં, ગલકડાં, મગ, શેરડી વગેરે ખાવાથી તેની પિતકારકતા ધરે છે. કંઈપ્રકૃતિ, વાયુપ્રકૃતિ, કંઈવાયુપ્રકૃતિ, ઠંડો પ્રદેશ, ઠંડી અસુ, સાત્ત્વિક સ્વભાવ તેમજ બચપણ અને વૃદ્ધત્વમાં શિવામ્બુ વધું પિતકારક નથી હોતું. તેનાથી જલકડું ગરમ, ખારું, તીખું, ક્ષારીય કે તળેખું ખાવાથી, ગરમીમાં રહેવાથી, કોધ કરવાથી, ગરમ પ્રદેશ, ગરમ પ્રકૃતિ, ગરમ રોગ, થૌવન, પહેલી ધાર વગેરેમાં શિવામ્બુ વધું પિતકારક બને છે.

નો કે, સામાન્ય લોડો શિવામ્બુને જેટલું ગરમ માને છે તેટલું બધું તે ગરમ નથી. દરેક પિતવાળી વ્યક્તિને તે માઝક ન જ આવે તેવું પણ નથી. કારણ કે આયુર્વેદાચાર્યોમાં પણ આ બાબતે થોડો ભતલેદ જોવા મળે છે. શિવામ્બુ જેમ પિતકારક છે તેમ પિતહારક પણ માનવામાં આવેલ છે. જેનો શાસ્ત્રીય આધાર આ પ્રમાણે છે :

— ધનવન્તરિનિધંડુના શ્લોષનો પ્રારંભ જ શિવામ્બુ પિતહર છે.’ તેવા શાસ્ત્રીય થાય છે.

‘પિતરકતકુમિહર’ શિવામ્બુ પિત અથવા પિતજ રોગો, રક્તજ રોગો અને કુર્મને હરે છે.’ ધણુ વૈદ્યો કે વિદ્વાનો

અહીં 'પિતરક્ત'ને સ્થળે 'રક્તપિત' અર્થ કરે છે પણ તેમ હોત તો અંથ કર્તાએ જ રક્તપિત શાખદ લખ્યો હોત. તેથી છંદલંગ થતો ન હતો અને અર્થ વધુ સ્પષ્ટ થતો હતો. પણ તેમના કહેવાનો ચોખ્યો હેતુ એ જ છે કે શિવામ્બુ પિતના અને રક્તના રોગો મટાડે છે.

-નિધંડુ રત્નાકરમાં પણ 'વાત', મોહં, કંઈ, પિતં નાશયેદ્વિતિ કીર્તિતમ् । -શિવામ્બુ વાયુ, મોહ, કંઈ અને પિતનો નાશ કરવામાં જણીતું છે.' અહીં લેખક મૂત્રનો પિત નાશ કરવાનો ગુણ અચ્છાતાં નથી રજૂ કરતા. પણ 'કીર્તિતમ्' શાખદ વાપરીને ખુલ્લેઆમ પિતનાશક હોવાનું કહે છે.

-'અષ્ટાંગ સંગ્રહ'માં ધન્વન્તરિ નિધંડુ પ્રમાણે જ કહ્યા ઉપરાંત 'નેત્રરોગ હરં પિતં પ્રષુદ્ધં ચ નિયચ્છતિ - શિવામ્બુ નેત્રરોગાને હરનારું અને પુષ્કળ પિતને મટાડનાર છે અથવા તેનું મોટી ભાત્રામાં સેવન કરવાથી વિરેચન ગુણથી પિતનું શોધન થઈ જય છે.'

પાંડુ, કમળો, રક્તહોષ વગેરમાં પિતનું રૈચન કરાવવા ગોમૂત્ર પાવાનો પ્રયોગ લખેલા-અમણુ સૌમાં પ્રચલિત છે જ. આયુર્વેદના પંચકર્મમાં વિરેચન કરનારાં દ્રવ્યોમાં મૂત્રનો પણ ઉદ્દેખ છે જ. -દુર્ઘંધ ચ મૂત્ર ચ વિરેચનાનિ ।

-યોગ રત્નાકરે પણ ધન્વન્તરિ નિધંડુનો જ કલોક સ્વીકારીને તેની પિતનતાનો સ્વીકાર કર્યો છે.

-ઇંગ્રિટ સંહિતામાં શિવામ્બુને મધુર કહીન તે રસમાં

મધુર છે કે વિપાકમાં? તે સ્પષ્ટ કર્યું ન હોવાથી બંનેનો સ્વીકાર થઈ શકે. જે દ્વય રસમાં કે વિપાકમાં મધુર હોય તે પિતનારાક હોઈ શકે.

શાલ્ક નિધિદુમાં સર્વમૂત્રના સામાન્ય ગુણ આપવામાં આવેલા છે તેમાં ‘શમયેત् (પતામ)’ તમામ મૂત્ર પિતનું શમન કરે છે.’ તેવું કહેલ છે. કૈયદેવ નિધિદુમાં બધાં જ મૂત્ર ‘કષેત્ત (પતા) અધો માગ્ યુક્તાં સેક્રાપનાલ્યો (ક્ષેત્ત ૪૨૭)–મૂત્રની ધાર કરવાથી અને પોટિસથી પિત નીચે તરફ લઈ જઈ શકાય છે.’ તેમ કહેલ છે.

આટલી ચર્ચાના અંતે નિખાલસપણે કહી શકાય કે આયુર્વેદાચાર્યાએચે કોઈ સ્થળે શિવામણુને ‘પિતકર’ કર્યું નથી. ઉણુ, તીણું, ખાડું, ક્ષારીય, ઉણુવીય, કદુવિપાકી હોવાથી પિતકાર હોવાનું અનુમાન કર્યું છે જ્યારે તેના વિરાધમાં ઉપરોક્ત દલાલો પણ છે જ. તેથી શિવામણુ ‘પિતકર’ છે કે પિતહર’ તે બાબતે સ્વાનુભવે દરેક વ્યક્તિએ અલગ અલગ નિણ્ણ્ય પર આવવું પડે તેમ છે.

૩. કર્ક્ષ : આયુર્વેદની લગભગ એકેએક સંહિતાએ શિવામણુને કર્ક્ષન કર્યું છે. કારણ કે શિવામણુમાં કર્ક્ષ વિપરીત બધા જ ગુણ-કર્મો છે. તે તીખા અને કડવા રસથી; ઉણુ, તીક્ષણ, દૃક્ષ, લઘુ અને ક્ષારીય ગુણથી કર્ક્ષન છે. ચરકે તેને કદુકસ્કર્ધ (તીઓ વર્ગ)માં સમાવેલ હોવાથી પણ કર્ક્ષન છે. ઉણુવીય અને કદુવિપાકી હોવાથી તે કર્ક્ષજ્ઞન્ય બધા જ રોગોને મરાડે છે. કર્ક્ષપ્રકૃતિ, બચપણ, વસ્તંત અને

હેમંત કાઠુ, ડાંડા અને જલીય પ્રદેશમાં શિવામ્બુ વધુમાં વધુ માઝક આવતું હોય છે. રસસાર, માંસસાર, મજબસાર અને શુક્ષસાર વ્યક્તિને પણ તે માઝક આવે છે.

**૪. ત્રિદ્વાષશામકતા:** ત્રિદ્વાષની દર્શિયે જેઈએ તો શિવામ્બુ સુખ્યરવે કક્ષની છે. તે પછી ખીજ નંબરે વાતદ્વા છે અને ત્રીજ નંબરે પિતની. જેમ આમળાં અનેક વિપરીત રસોનું ગુણવાળું શિવામ્બુ પણ પ્રભાવથી કદાચ ત્રિદ્વાષશામક હોઈ શકે. જે કે તેનામાં તેવે પ્રભાવ હોવાનો ડાઈ અન્થમાં ઉદ્દેખ નથી. છતાં આજના યુગમાં વ્યાપક અને પુષ્કળ અનુભવે પિતના રોગોને પણ મટાડતું જોવામાં આવે છે તેથી તેને પ્રભાવથી ત્રિદ્વાષશામક છે તેમ કહેવું હોય તો કહી શકાય.

\*

## ૦ શિવામ્બુ... રસોની દર્શિયે-

વિશ્વનું ડાઈ પણ દ્વય પંચમહાભૂતના બધારણ વિના અન્ય ન હોવાથી પંચમહાભૂતજ્ઞન્ય છ રસોમાંના રસો પણ શિવામ્બુમાં છે. આપણે તે રસોના ગુણ-હોષ તપાસીએ :

**૧. ભધુર (ગાજ્યો) રસ :** ડેવળ શાલિયામ નિધંડુ અને હારિત સંહિતામાં જ શિવામ્બુને ભધુર કહેલ છે. તે રસરૂપે, અનુરસરૂપે કે ભધુર વિપાક રૂપે? તે અસ્પષ્ટ છે. જ લોડો ખાડું, ખાડું, તીખું, ગરમ ખાતાં ન હોય, ગરમ દવા લેતાં ન હોય, નિવ્યંસની હોય, પિત્ત

પ્રકૃતિ ન હોય, પ્રદેશ ગરમ ન હોય અને દૂધ, મીઠાં ઝણો, મીઠાઈ, ઘઉં, ભગ જેવો મધુર આહાર લેતા હોય તેવી વ્યક્તિનું મૂત્ર મધુર એટલે કે નાળિયેરના પાણી જેવું, નીરા જેવું કે સાદા ભાંભળા પાણી જેવું હોય છે. દૂધ પીતાં બાળકેનું મૂત્ર પણ તે જ ઢારણે મધુર હોય છે. આવા મધુર રસવાળા શિવામ્બુમાં પૃથ્વી અને જળ તરવ વધારે હોવાથી તે ગરમ પડતું નથી અથવા ઓછું ગરમ પડે છે. તે પિતનું અને વાયુનું શમન કરે છે પણ કેક કરતું નથી. કેંનું તો શમન કરવાનો તેનો ગુણ હોવાથી ત્રિહોષશામક બને છે.

શિવામ્બુ મધુર હોવાને શાલ્કીય આધાર આ પ્રમાણે છે :

(૧) માનુષ ક્ષારકદુક મધુર ચ ઉચ્ચયતે !  
—હારિત સંહિતા, પ્ર. અ. ૧, મૂત્રવગ

(૨) મધુર લધુ દીપન કરેનાશનમ ।  
—શાલ્કિયામ નિધારુ, મૂત્રવગ

૨. અગ્નિ(ખારો) રસ : શિવામ્બુમાં ખારો રસ નથી. કવચિત વધુ ખટાશ ખાતારને અનુરસ ઇપે કચારેક ખટાશનો જરાતરા અનુભવ થતો હોય છે. ખટાશવાળા શિવામ્બુમાં પિતકારકતાનો ગુણ વધારે હોય છે.

૩. લવણુ(ખારો) રસ : રાજનિધારુમાં અને ભાવ-પ્રકાશમાં ‘તિક્તોળણુ’ લવણુ ઇક્ષમુ’ અને નિધારુ રત્નાકરમાં ‘સક્ષારલવણુ’ સ્મૃતમ-તે ક્ષારીય અને ખારું કહેલ છે.’

તેમ કહ્યું છે. કારણ કે શિવામ્બુમાં પ્રાયઃ પ્રથમ વ્યક્ત થતો રસ ખારો છે. આ ખારાશ તેમાં ક્ષારીયતાને કારણે છે. તેમાંથી માનવમૂત્રક્ષાર (શિવામ્બુક્ષાર) બનાવવામાં આવે (ગોમૂત્રક્ષારની વિધિ પ્રમાણે) તો તે સ્વાદમાં ખારો હોય છે. આ કારણે શિવામ્બુમાં પાયન, રુચિકર અને પિતકર ગુણ હોય છે. જે વ્યક્તિના આહારમાં મીડું કે ક્ષાર વધુ હોય છે તેના મૂત્રને સ્વાદ વધુ ખારો હોય છે. તેથી જ શિવામ્બુક્ષારપદમાં ‘શિવામ્બુસેવન કરનારે ખારું’ કે ક્ષારવાળું ન ખાવું’ તેવા પથ્યપાલનનું વિધાન છે. કારણ કે શિવામ્બુસેવન કરનારના શરીરમાં ખારાશ અને ક્ષાર તો શિવામ્બુ દ્વારા હુમેશાં પૂરતા પ્રમાણમાં લેવાય કરતા હોય જ છે.

હુમેશાં ક્ષારનું સેવન કરવાની આયુર્વેદમાં મનાઈ છે, છતાં શિવામ્બુ રસાયન અને બહ્ય હોવાથી અપવાદ રૂપ ગળ્ણી શકાય.

૪. કંડુ (તીખો) રસ : શિવામ્બુના બંધારણુમાં અગ્રિ તરત્વ અથવા પિત હોવાથી તે રસમાં તીખું છે. (કંડુનો અર્થ આયુર્વેદ પ્રમાણે તીખો કરવાનો છે. સાહિત્યમાં ‘કંડુ’નો અર્થ ‘કડવો’ કરવામાં આવે છે તે યોગ્ય નથી.) તીખું હોવાને કારણે શિવામ્બુ ઇક્ષ, લધુ, ઉણુ, તીક્ષ્ણ અને લેખન ગુણવાળું, ઉણુવીય અને કંડુવિપાશ્મી (પચે ત્યારે તીખું) છે. તે કારણે તે જરૂરાગ્નિને પ્રદીપ્ત કરે છે, ભૂખ લગાડે છે, આમનું પાયન કરે છે, શિરો

વિદેયન છે, કંઈનો નારી કરે છે જેથી કંઈના ૨૦ રોગોની  
મટાડવામાં ઉપયોગી બને છે. ચામડીના રોગોની, નેત્રરોગોની,  
શરદી, અરુચિ, અજુણું, કૃમિ, પ્રમેહ, કંઈજવર, વિષ,  
મોહ (તંદ્રા) વગેરે રોગોને મટાડવામાં મદદ કરે છે.

કૈયદેવનિધિનુમાં ‘નરમૂત્ર’ કંદુ ક્ષારં વિષધનં ચ રસા-  
યનમ्’ કહેલ છે તેમાં પ્રથમ સુખ્ય રસ કંદુ કહેલ છે.  
હારિત સંહિતામાં ‘માનુષં ક્ષારકંદુકું-માનવમૂત્ર ક્ષારીય  
અને તીખું છે, તેમ કહ્યું છે. ચરક સંહિતામાં તેને કંદુકું  
સ્કંધ (તીખા વર્ગ)નું દ્વારા માનેલ છે. શિરેવિરેચન,  
આત્મવજનન, અતઃસ્તાવવર્ધક, લેખન, જરૂરદન વગેરે  
ગુણો શિવામ્બુસાં રહેલા તીખા રસને આભારી છે.

શિવામ્બુસાં તીખા રસ લગભગ ત્રીજી કંમે છે.

ગરમ પ્રહેશ, ગરમ ઝડપુ, ગરમ પ્રકૃતિ, ગરમ આહાર,  
મરચાં, મરી, રાઈ, અજમા જેવા કંદુ વિપાકી તીખા  
રસનું અતિ સેવન કરવાથી શિવામ્બુસાં તીખા રસનું  
પ્રમાણે વધે છે, અને દૂધ, ઘી, દ્રાક્ષ, શેરડી, મીઠાં ઇણોં;  
મધુર, ઠંડા ખારાક ખાવાથી, વધુ પાણી અને વધુ દૂધ  
પ્રીવાથી; ખારાશ, ખારાશ, તીખાશ વિનાનો સૌખ્ય ખારાક  
ખાવાથી શિવામ્બુસાં તીખા રસનું પ્રમાણ ધરે છે. કંઈ  
પ્રકૃતિ, ઠંડા પ્રહેશ, બયપળું, સૌખ્ય આહાર, સૌખ્ય ઔષધો  
વગેરે કારણે શિવામ્બુસાં તીખા રસ નહીંવત્ત જ જેવા  
મળે છે.

૫. તિક્ત (કંડવો) રસ : તિક્ત એટલે તીખા નહીં

પણ કડવો રસ (સાહિત્યમાં તિક્તનો અર્થ તીખો કરવામાં આવે છે તે એકું છે.) આકાશ અને વાયુ મહાભૂત મળીને કડવો રસ બનતો હોવાથી કડવા રસની પ્રધાનતાવાળું શિવામ્બુ વધુ ગરમ નથી હોતું. જિલ્દું પિતશામક હોય. છે. તે વધુ લઘુ અને વધુ ઇક્ષ ગુણવાળું હોવાથી કેઝે પણ સવિશેષ મટાડે છે. શિવામ્બુને કડવો રસ સાત્ત્વિકતા. આપીને વ્યક્તિને આધ્યાત્મિક વલણું તરફ આક્ષેં છે તેથી યુદ્ધ, મેધા વધે છે. કૂમિ, જવર, દાહ, અમલપિત, ચર્મ-રાગ, વિષ, નેત્રરાગ, પ્રણ, ચર્મરાગો તેમાં ખાસ કરીને રાતી ખસ, અરુચિ. અજુણું, તંડા, અતિ નિદા, રક્તહોષ, તમસ, આમ, પિતના અને કેઝના બધા રાગો મટાડે છે.

કડવો રસ જેમાં પ્રધાનપણે હોય તેવું શિવામ્બુ ત્રિદ્વારશામક ગુણવાળું કહી શકાય.

શિવામ્બુમાં કડવો રસ ખીંચ સ્થાને છે.

૬. કુધાય રસ: તૂરો રસ પૃથ્વી અને વાયુના મિશ્રણથી બનલો હોય છે. જે શિવામ્બુમાં લગભગ નથી છતાં, શિવામ્બુ ઉપર પાણી પીવાથી તે મીઠું લાગતું હોવાથી અનુરસ રૂપે કુ આંશિક રૂપે હોવા સંભવ છે.

\*

## ૦ શિવામ્બુ...ગુણોની દાખિયો-

આયુર્વેદમાં સાંખ્યદર્શન અનુસાર ૨૦ ગુણોનું વર્ણન છે, જેના દ્વારા દ્વય કાર્ય કરતાં હોય છે. ૫૨ંતુ તે વીશો

માંના આઠ ગુણુ વધુ પ્રયક્ષિત અને શિવામ્બુદ્ધને સમજવા ઉપયોગી હોવાથી આપણે તેટલાની વાત કરીશું.

૧૦. ઉષણુ : અહિન ભષાભૂતમાંથી બનેલો આ ઉષણુ ગુણુ શીતગુણુનો છેદ ઉડાડે છે. પિત ઉષણુ હોવાથી ઉષણુ ગુણુ પિતવર્ધક છે. શિવામ્બુમાં ઉષણુ ગુણુનો સ્વીકાર સર્વસામાન્ય છે. અને એ કારણે જ તે થોડા ડે વધુ પ્રમાણુમાં પિતકારક છે તેમ માનવામાં આવે છે.

શિવામ્બુ ઉષણુ, તીક્ષ્ણુ, ખારું અને તીખું હોવાથી તે કેઝના અને વાયુના તમામ રોગોને મટાડે છે; પાચન, દીપન, અહિનવર્ધક, આમપાચક અને લઘુ છે. વાત પ્રકૃતિ, કેઝવાત પ્રકૃતિ, વૃદ્ધો, બાળકો, કેઝના અને વાયુના રોગીને વધારે માફક આવે છે. જ્યારે તેનાથી જિલદું ગરમ પ્રદેશ, ગરમ પ્રકૃતિ, ગરમીના રોગોં, થૌવન વગેરેમાં કેટલીકવાર (સોમાંથી એ પાંચ વ્યક્તિને) માફક નથી આવતું.

ખારું, ખારું, તીખું, ગરમ ખાવાથી; પિત પ્રકૃતિથિ, ગરમ ઋતુથી, ગરમીના રોગથી ડે ચીડિયા સુવલાવથી શિવામ્બુમાં ઉષણુતાનો ગુણ વધુ પેદા થાય છે.

ઉષણુ હોવાને કારણે શિવામ્બુ કેઝ, વાયુ, કુમિ, તંદ્રા, આમ, ત્વર્ગ્રહાષ, નેત્રરોગ, અરુચિ, અજુણુ, શારદી, શ્વાસ, ઉધરસ, શીળસ, પક્ષાધાત, રંજણુ, સંધિવાત, આમવાત, મેદ, શૂળ. સોંભે, રાતી ખૂસ, ખરજવું, દાદર, સોરાયસીસ ધોળો ડોઢ, ખીંચ, પોંડો, કબુજિયાત, ગોળો, ગોસ, મોતિયો,

યક્ષમા આવવા, દષ્ટિ હૌર્ણ્ય, આંખના ચીપડા, કંકળ  
કે વાતજ શિરઃશળ, સાયનસ, મેલેરિયા, ઇલ્યુ, કંકળવર,  
વાતજવર વગેરેને મટાડવામાં સહાયક બને છે.

ઉધ્ગુ હોવાથી શિવામ્બુ પાચન, દીપન, રેચન,  
વાતાનુલોમન (વાયુને નીચે લઈ જનારો ગુણ), રેચન,  
શિરાવિરેચન, આત્વજનન, જતુંન, લેખન, યકૃત  
ઉતેજક, ક્ષારીય, શોધન વગેરે ગુણવાળું છે.

૨. લધુ : શિવામ્બુમાં અગ્નિ તત્ત્વ હોવાથી; ખારું,  
કડવું, તીખું અને ગરમ હોવાથી લધુ એટલે કે હળવું છે.  
તેથી પીવાની સાથે તુરત પચી જથું છે. લધુ ગુણને કારણે  
શિવામ્બુ સાર્વિક, સ્ક્રૂતિંપ્રદ, ઉત્સાહપ્રદ, પાચન, દીપન,  
શિરાવિરેચન અને આમપાચન છે.

શિવામ્બુનો લધુ ગુણ ગુરુ ગુણથી વિપરીત છે. તે  
કારણે તે મેદનાશક, આળસ દૂર કરનાર, વધુ પ્રમાણુમાં  
ઓંધ હોય તો તેને ઓછી કરનાર, આમવાત, ખંજવાળ,  
કુમિ, મોહુ, સોઝ વગેરે મટાડવામાં સહાયક બને છે.

બધા જ શાસ્ત્રકારોએ શિવામ્બુને સર્વાનુભતે લધુ  
ગુણવાળું ગણાયું છે. રાજનિધંદુના કહેવા પ્રમાણે 'નરાણાં  
તું ભવેત્ સવ્ પાચન દીપન' લધુ :—બધા પ્રકારનું માનવ-  
મૂત્ર પાચન કરનારું ભૂખ લગાડનારું અને પચવામાં હળવું  
છે.' શાલિશ્રામ નિધંદુમાં તો તેને મધુર અને કંકનાશક  
કલ્યા ઉપરાંત લધુ કહ્યું છે. 'મધુર લધુ દીપન' કંકનાશનમ'  
હારિત સંહિતામાં પણ તે જ રીતે 'મધુર લધુ ય ઉચ્ચયતે'  
કહ્યું છે.

૩. ઇક્ષા : શિવામ્બુમાં રહેલ અગ્નિ તરવ ઉણુતા; તીખો તથા કડવો રસ અને ક્ષારીયતા ઇક્ષતાનું કારણ છે. ઇક્ષ ગુણથી વિરુદ્ધ ગુણ સ્થિતિ હોવાથી શિવામ્બુ રોગોની સ્થિતિ કરતાને દૂર કરતું હોવાથી અને કંઈ સ્થિતિ હોવાથી કિંના બધા જ રોગાને મટાડે છે. શરદી, આમ, કંઈજન્ય રોગો, આમાતિસાર, પ્રણ, પ્રણ, આમ, વાળની વધુ ચીકાશ, ત્વચાની ચીકાશ, સ્વભાવની ચીકાશ વગેરે દૂર કરે છે. તેનાથી સ્નાન અને માલિશ કરવાથી ત્વચા, વાળ વગેરે ચોખ્ખા થાય છે. તેના ફોગળાથી પણ દાંત ચોખ્ખા થાય છે અને મેંની ચીકાશ દૂર થાય છે.

કેટલાક વિદ્વાનો શિવામ્બુને 'ઇક્ષ' નહીં પણ 'અઇક્ષ' એટલે તે ચીકણું પણ નથી અને લૂણું પણ નથી તેવું કહે છે. ખરેખર અનુભવે શિવામ્બુ પ્રોવાથી કે માલિશ કરવાથી ઇક્ષતાનો અનુભવ થતો નથી. તેથી ત્વચા, વાળ વગેરે જિલ્લાના મુલાયમ બને છે! તેના માલિશથી તે વ્યાધિયા, ત્વચાઇક્ષતા દૂર કરી સ્થિતિ અપેં છે!

રાજનિધિંડુમાં 'તિક્તોણું લવણું ઇક્ષા' એમ રહેલ છે. નિધિંડુ રત્નાકરમાં પણ 'તિક્તાં ઇક્ષાં' ચ ગ્રેક્ઝાં કહીને 'ઇક્ષા' જ કહ્યું છે.

૪. તીક્ષણ : અગ્નિ તરવ, ઉણુતા, તીખો અને ખારો રસ વગેરે કારણે શિવામ્બુ તીક્ષણ (ઉચ્ચ) છે.

'નિધિંડુ રત્નાકર' અને 'ભાવ પ્રભાશ'માં એક સરખા જ શ્લોકમાં શિવામ્બુને 'તીક્ષણ' કહ્યું છે.'

રક્તપામાહરં તીક્ષ્ણં સક્ષારં લવણું સમૃતમ्—શિવામ્બુ  
દ્ધાલ ખસને મટાડે છે. તીક્ષ્ણ છે, ક્ષારીય છે અને  
ખારું છે.'

તીક્ષ્ણ ગુણની અન્ય બાબતો 'ઉણુ' ગુણમાં જોઈ  
લેવી. તે બંને ગુણ મળતા હોવાથી અહીં પુનરાવર્તન  
કર્યું નથી.

\*

### ૦ શિવામ્બુ...વીર્યની દર્શિયે-

'શીતોષ્ણમય' જગત-આ જગત શીત અને ઉણુ  
છે.' એટલે કે ચંદ્ર અને સૂર્યની ઠંડી-ગરમ તાસીરવાળું  
આખું જગત છે. તેથી તેમાંના પ્રત્યેક દ્વયમાં શીતતા,  
ઉણુતા કે શીતોષ્ણતા હોવા સંભવ છે. ને દ્વયોમમાં  
સૂર્યશક્તિ એટલે કે અહિની પિત્રાદિઓ પ્રમાણું બંધા-  
રણમાં વધારે હોય છે તે ઉણુ; અને આકાશ, વાયુ,  
જળ, પૃથ્વી તરવાળા, ચંદ્ર શક્તિવાળા કે કેવાયુના  
બંધારણવાળાં દ્વયો ઠંડાં હોય છે. શિવામ્બુમાં અહિની  
તરવ અથવા પિત વધારે હોવાથી તે ઉણુવીર્ય છે. તેની  
બધું વિગત ઉણુ ગુણ અનુસાર જોઈ લેવી.

\*

### ૦ શિવામ્બુ...વિપાકની દર્શિયે-

ભધુર વિપાક, અમલવિપાક અને કદુવિપાક એમ ત્રણ  
વિપાક આયુર્વેદમાં દર્શાવ્યા છે. વિપાક એટલે કોઈ પણ

આહાર કે દ્રવ્ય પેટમાં પણે ત્યારે તેની છેલ્ખી સ્થિતિ. મધુર, ખારા (મધ્ય, સિંધવ સિવાયના) બધાં જ દ્રવ્યોનો મધુર વિપાક થાય છે. (આમળાં, મીઠાં દાડમ સિવાયના) બધાં જ ખાટાં દ્રવ્યોનો અમલવિપાક થાય છે. જ્યારે તીખાં, તૂરાં અને કડવા (લવિંગ, સુંઠ, આંદુ, લસણ, લીંડીપીપર, હરડે, ગળો સિવાયના) બધાં જ દ્રવ્યોના વિપાક કંકુ થાય છે. તે નિયમ પ્રમાણે શિવામણુમાં મુખ્ય તીખાં, તૂરોા, કડવો રસ હોવાથી, ક્ષારીય હોવાથી અને ઉણવીય હોવાથી તે કંકુવિપાકી છે. એટલે કે શિવામણુ પણ છે ત્યારે તીખું બની જય છે. તેથી તે ગરમ પડે છે. બળતરા કરે છે. ગરમીમાં માર્ક આવતું નથી. જો કુ, હારિત સંહિતામાં અને શાલિગ્રામ નિધંદુમાં મધુર કહેલ છે. લવણુ રસ તો તેમાં છે જ તેથી તેનો અર્થ કદાચ મધુર વિપાક કરવામાં આવે તો તે મધુર વિપાકી હોવાની શાંકા છે. તેને પિતશામક કે ત્રિદોષશામક કહેતી વુખતે ડેટલાક વિદ્ધાને તેના મધુર વિપાકનો ખ્યાલ હોવા સંભવ છે. શાલ્વ અને વૈઘો તો શિવામણુને કંકુ વિપાકી માને છે પણ મારા અંગત અનુભવે મને મધુર વિપાકી જણાયું છે. કારણ કે કંકુવિપાકી દ્રવ્ય વાયુકારક, આફરો કરનાર, ગરમ, ગુદ્દાહ કરનાર અને ઊનવા કરનાર હોય સંભવ છે તેથી મુખ્યત્વે વાયુ અને અદ્યપાંશે તે પિતપ્રકોપ કરે છે તેમ કંઈ શકાય. પણ, તેનાથી ઊલદું, શિવામણુ તો વાયુનાશક છે. આફરો, ઊનવા, અશો, મરડો વગેરેને તે મટાડે છે ! તેથી શક્યતા છે કે મધુર

વિપાકી હોય. અન્ય અષ્ટ મૂત્ર લલે કદુ વિપાકી હોય  
પણ માનવમૂત્ર ડેવળ મધુર વિપાકી જેમ ન હોઈ શકે ?  
વૈધોએ આ બાબતે ચોક્કસ અનુભવે કરવા-કરાવવા જોઈએ,  
કારણ કે આયુર્વેદના કોઈ ગ્રન્થમાં શિવાભ્યુ ‘કદુવિપાકી’  
છે તેવું ચોક્કસ રાખેલામાં કહ્યું નથી. મૂત્રવર્ગમાં અષ્ટ-  
મૂત્રને કદાચ કચાંય કદુવિપાકી કહેલ હશે, પણ માનવ-  
મૂત્રના ગુણ તો તે બધા કરતાં ચ્યાઢિયાતા છે. ‘રસાયન’  
‘બદ્ય’ વગેરે ગુણવાળું હોવાથી તે મધુર વિપાકી હોય  
તો શિવાભ્યુનું મૂદ્ય આયુર્વેદની દાખિયા ધણું વધી જય  
છે. કારણ કે રસ કરતાં ગુણ, ગુણ કરતાં વીય અને  
વીય કરતાં વિપાક બળવાન હોય છે. હરડે, આમળાં,  
ગળા જેવાં અપવાહ દર્શયોની જેમ ‘વિકૃતિ વિષમ સમવાય’  
(વિચિત્ર પ્રત્યારખધ) એટલે કે જેના બધારણુમાં રસ,  
ગુણ, વીય, વિપાક વિચિત્ર કે વિષમ પરિણામ બતાવનારા  
હોય છે તેમ આ શિવાભ્યુમાં પણ હોઈ શકે. મને લાગે  
છે કે શિવાભ્યુમાં આ વિકૃતિ વિષમ સમવાય (બધુ વિષમ  
રીતે ભેગું થયેલ) હોય છતાં સમવાળે લાલહાયી હોવાથી  
તે તૂરું, કડવું, તીખું, લૂખું, હળવું અને કદુવિપાકી  
હોવા છતાં વાયુને મટાડે છે. ખારું, તીખું, ક્ષારીય,  
ગરમ, ઉણગીય અને કદુવિપાકી હોવા છતાં પિતને  
મટાડે છે. અને દ્રવ, કિંચિત મધુર, લવળ, મધુરવિપાકી  
હોવા છતાં કુઝને મટાડે છે.

## ૦ શિવામ્બુ...પ્રલાવની દિશાએ—

પ્રલાવ એટલે ચ્યમતકાર. ‘અચિન્ત્યશક્તિઃ પ્રલાવः  
જે દ્રવ્યમાં ખુદ્ધથી ચિંતની ન શકાય, તેવાં જ્ઞાની પરિ-  
ણામે લાવવાની શક્તિ હોય તેને પ્રલાવકારી દ્રવ્ય કહી  
શકાય.) જેમ (ભાર્ગ પ્રલાવથી શ્વાસ મટાડે છે, આમણાં  
પ્રલાવથી ત્રિહોષશામક છે, સહદેવીનું મૂળ માથે બાંધવાથી  
તાવ ઉતરે છે, અઘેડો બાંધવાથી પ્રસૂતિ થાય છે, પીપળા-  
નાં પાન કાનમાં નાખતાં પ્રલાવથી સર્પવિષ ઉતરે છે તેમ.)  
આયુર્વેદમાં અગણિત વનસ્પતિના ઈમર્જન્સી પ્રલાવ  
પ્રયોગો આપેલ છે તેમ મને તો લાગે છે કે ડેઈ અન્થકારે  
શિવામ્બુમાં પ્રલાવ હોવાનો ઉદ્દેશ ન કરેલ હોવા છતાં  
તે પ્રલાવકારી દ્રવ્ય હોવું જોઈએ. તેનામાં રહેલ આયુર્વેદાકૃત  
રસાયન ગુણ, શિવામ્બુ કદમ્પમાં કહેવા પ્રમાણે દ્રવ્ય ગુણ  
અને શ્રી આમ્સ્ટ્રોંગના અનુભવ પ્રમાણે મેજિઝ વોટર  
(જ્ઞાની જળ) વગેરે તેનામાં પ્રલાવ હોવાની સાક્ષી પૂરે  
છે. મૃત્યુના મુખમાં પડેલા અનેક રોગીઓને શિવામ્બુએ  
ચ્યમતકારિક રીતે પ્રલાવથી થોડા સમયમાં જ જીવાડચા  
છે. જુઓ, શ્રી આમ્સ્ટ્રોંગનું પુસ્તક ‘ધી વોટર ઓઝ  
લાઇફ’ અને શ્રી રાવાલુભાઈનું ‘માનવમૂર્ત્ર.’ તે ઉપરાંત  
કેન્સર જેવા અસાધ્ય કેસ અને એઈડ્રૂઝના મટવા અશક્ય  
‘કેસ પણ હમણાં હમણાં સત્ય ઘટનારૂપે પ્રગટ થયા છે.  
તેવાં સેંકડો કેસ ડેઈ વિશાળ હુદ્દ્યી મહાવૈદ્ય વાંચે અને  
શિવામ્બુના ગુણ ફરીને લખે તો અવસ્થ એમાં ‘પ્રલાવ’  
ગુણ ઉમેરે જ.

## ૦ શિવામ્બુ...અન્ય ગુણ-કર્મની હંપિએ-

૧. રોચનમ-રોચનમ એટલે તુચ્છિકારક. શિવામ્બુમાં ખારો, કડવો અને તીજો રસ હોવાથી, તે ઉષ્ણવીઠ્યે હોવાથી, આમપાયક અને કદ્વન હોવાથી તેમાં તુચ્છ કરવાનો ગુણ રહેલો છે અને તે કારણે શિવામ્બુનું સેવન કરનારને આહારની તુચ્છિમાં વધારો થાય છે. ધનવન્તરિ નિધિંદુ અને અષ્ટાંગ સંપ્રદાયમાં શિવામ્બુને 'રોચનમ' કહ્યું છે.

૨. હીપનમ-હીપન એટલે ભૂખ લગાડનાર. તુચ્છ થવી તે મોં અને મનનો વિષય છે તો ભૂખ લાગવી તે પેટનો. ઉપર કહેલા બંધારણુથી શિવામ્બુ તુચ્છિકરની જેમ જ ભૂખ લગાડનાર છે કારણું કે તે જઠરાળિને પ્રદીપ્ત કરનાર છે.

૩. આમદનમ-રાજનિધિંદુમાં તથા શોઢલ નિધિંદુમાં શિવામ્બુનો 'આમદન' કે 'આમહર' ગુણ કહ્યો છે. જેનો ઘણ્ણી વિશાળ વ્યાખ્યા થઈ શકે. આયુર્વેદમાં 'આમ' શાખદુઃ અનેકાથી, વિશાળ અને મહત્વનો છે. આહાર, ધાતુઓ, મળો વગેરે જ્યારે કાચા રહે છે ત્યારે સામ (સ+આમ) અને છે અને એ સામ વાયુ, સામ પિત, સામ કંઈ જતનીતના રોગોનું કારણ બને છે. આમમાં ચીકાસ અને ગૌરવ હોવાથી શરીરના સૂક્ષ્મ સ્નોતોમાં તે જ્યાં પુસાર થાય ત્યાં ચીકાશ, અવરોધ અને સંધાત પેદા કરી તે તે સ્થાનનો અને તે તે હોષનો રોગ પેદા કરે છે. તેથી જ તો 'આમ' હિસ્સે રોગાણું મૂલમ-આમ જ બધા રોગોનું મૂળ છે, તેમ કહેવામાં આવેલ છે/અને, તેને નિદ્ધાનનું

અગ્રતમ સૂત્ર માનવામાં આવેલ છે. આવું જ એક અગ્રતમ સૂત્ર ચિહ્નિત્સામાં પણ કહેવાયેલું છે. નિરામ રહેણસ્થ હિલિષણનિ, ભવનિત યુક્તાનિ અમૃતોપમાનિ' - દેખ (આમરહિત) થાય પછી જ યુક્તિપૂર્વક આપવામાં આવેલાં ઓષ્ઠો અમૃતરૂપ થાય છે. (નહીં તો જેરિપ.) નેચરેપથી-માં જેને શારીરવિષ કહેવામાં આવે છે તે આ આમ.

આનો સાધો—સરળ અર્થ એ થયો કે આમને કારણું બધા રોગો થાય છે. જ્યારે શિવામ્બુ 'આમદનં હોવાથી તે બધા જ રોગાને ભટાડી શકે છે. અથવા શિવામ્બુ સેવન કરવાથી નિરામ રહેવાય છે કે નિરામ થવાય છે. શિવામ્બુ સેવન કરીને નિરામ થયા બાદ આપવામાં આવેલાં બધાં જ ઓષ્ઠો પરિણામદાયી બને છે. શિવામ્બુના સકળ કેસ તપાસશો તો તેમાં લંઘન સાથે શિવામ્બુ સેવનથી પરિણામ મળવાનું રહેણ્ય તેના આમદન ગુણમાં રહેલું જણાશે.

ટૂંકમાં, શિવામ્બુ ચિહ્નિત્સાની સૌથી વધુ સકળતા અને ત્વરાનું શિવામ્બુમાં 'આમદન' ગુણને કારણું જ પ્રાયઃ છે તેમ સ્વીકારવું પડે તેમ છે.

૪. બદ્ધમઃ હારિત સંહિતામાં 'ચક્ષુરોગળુરુ' બદ્ધ દીપન કરુનાશનમ્' અને શાકીયામ નિધંતુમાં તે જ શાખામાં શિવામ્બુને 'બુદ્ધુ' કહ્યું છે.

શિવામ્બુમાં રહેલા કિંચિત્ ભધુર રસ, ભધુર વિપાક, હૃદ, રસાયન અને આયુષ્યવધક ગુણથી તે બળ વધારનારુ

છે. શિવામ્બુ સેવન કરનાર મોટા લાગની વ્યક્તિનો પ્રથમ અનુભવ તે શક્તિ, સ્ક્રૂતિ<sup>१</sup> અને બળ આપવાનો ગુણ હોવાનો। છે. ઉપવાસમાં શિવામ્બુનું સેવન કરવામાં આવે તો તે કારણે જ અશક્તિ નથી આવતી. શરીર-મત અનેનું બળ વધારે છે.

શિવામ્બુકલ્પના અનેક શ્લોકમાં શિવામ્બુ બળવધ<sup>२</sup>નું હોવાનો ઉદ્દેશ છે જુઓ :

—સતમાસ પ્રયોગેણ જયતે ખલબતરः ૧૨૩  
સાત માસ સુધી શિવામ્બુ સેવનનો (વ્યવસ્થિત) પ્રયોગ કરવાથી વ્યક્તિ વધારે બળવાન થાય છે.

—એક વર્ષાલ્યાસરશાત જયતે ખલબતરः ૧૨૪  
હરદેના ચૂર્ણનું અનુપાન ચાંડુ રાખાને એક વર્ષના અભ્યાસથી શિવામ્બુસાધક વધુ બળવાન બની જય છે.

—થાર વરસુ સુધી ઉપલેટ(કડ)ના અનુમાનથી શિવામ્બુનું સેવન કરવાથી હાથી જેટલું બળ મળે છે. (શ્લોક ૨૬)

—શુદ્ધગંધક અને અભ્રકના અનુમાનથી સાધક બળવાન થાય છે. (શ્લોક ૨૮-૨૯)

—પયોભક્ષઃ સતતવર્ષનિત્યં પાનં શિવામ્બુનઃ।  
કરેાતિ સતત રોગનાશન ખલપુણિદૃકૃત ૧૩૮  
જે વ્યક્તિ સતત વર્ષ સુધી રોગ દુર્ખાહારી રહીને નિયમિત શિવામ્બુનું પાન કરે છે તેના રોગો મટી જય છે અને તેનું બળ અને પુણિ વધે છે.

—प्रातः शिवाम्बुपानेन निर्गुण्डीपयसक्षमात् ।  
जयते अगवान् योगी हीर्दृदृष्टिः कृतार्थकः ।४२  
जे साधक प्रातःकाले शिवाम्बुपान इरीने उपर नगोडना-  
पान आय छे ते अगवान अने छे.

—सर्वदा पूर्णितं विक्षोषधं योगीथरो पिष्टतः ।  
पश्चाम्भवाम्बुपायी च महाअलं पराक्रमः ।४८  
जे साधक हमेशा सूर्दुङ्गु यूर्ण आईने उपर शिवाम्बु  
पीजे छे ते महा अगवान अने पराक्रमी थर्छ जय छे.

—महोषधं महादेवि ! मधुरत्रय भित्रितम् ।  
सनिर्गुण्डीपत्ररसं पिष्टेच्छवजलान्वितम् ।६३  
एक आसेन हेविशि ! हठांगोडभित विक्रमः ।

हे महादेवी ! वर्णेय मधुर पदार्थी (मध, साकर, धी)  
मेगवीने सूर्दुङ्गु यूर्ण अने नगोडना पाननो २स महोषध  
(शिवाम्बु) मेगवीने पीवामां आवे ते एक महिनाना  
प्रयोगथी अधां अंगो मज्ज्युत थर्छ जय छे अने पुष्टग  
अग अगे छे.

—नस्यं प्रातः प्रकुरुते योगी हेवी ! शिवाम्बुनाः ।  
कङ्करोगाः विनश्यन्ति वातरोगास पैतिकाः ।८५॥  
ज्वलज्वलठर्वलिः स्यादतिकायभ्लोडभः ।

हे हेवी ! जे योगी सवारे शिवाम्बुतुं नस्य ले अथवा  
नाईथी पीजे तेना कङ्क-वात-पितज्जन्य रोगो द्वार थाय  
छे. तेना जठराग्नि अज्जवलित थाय छे अने ते निर्बंग

હોય તો પણ અતિ બળવાન બની જય છે.

—શિશિર કંતુમાં લીંડીપીપર, સુંડ અને હરદેસું  
ચૂંઝું સમાનલાગે ખાઈને ઉપર શિવામ્બુ પૂછે છે તેને  
હાથીના જેટલું બળ પ્રાપ્ત થાય છે.—(કલેક્શન ૧૦૨-૨૦૩)

શિવામ્બુ બદ્ય હોવાથી તાપ, ઠંડી, થાક અને  
વૃદ્ધાવસ્થામાં આવેલી નિષળાઈ દૂર કરી તાજી અને  
ઉત્સાહ આપે છે.

વૈદ્ય શ્રી મગનલાલ સલારિયા પોતાના દરદીઓનાં  
ઓપરેશન કરતાં પહેલાં હૃદયબદ્ધ દ્વય રૂપે સ્વમૂત્ર પાતાં.  
પોતાની ૪૫ વર્ષની ઉંમરે સન् ૧૯૫૮માં એપેન્ડિક્સનું  
ઓપરેશન કરેલું તેમાં તે કરતાં પહેલાં એક કલાકે એટ્રો-  
પિન વગેરે ધંજેકરણનો આપવાને સ્થાને એક દરદી ખીને  
તેનું પોતાનું શિવામ્બુ પિવરાવેલું. તેથી તેના હૃદયની  
ગતિમાં નિર્ભિંગતા જણાઈ ન હતી. અને હૃદયનું આવશ્યક  
બળ જળવાઈ રહ્યું હતું. આ પદ્ધતિથી લગભગ વીશ  
જેટલાં ઓપરેશનનો તેમણે કરેલાં. તેમાં ડાયા સ્તતનમાં કેન્સર,  
ગળાની ગાંઠો. લાયપોમા, લગંદર, કાકડા વગેરે મુખ્ય  
હતાં. તેમાં કોઈને નુકસાન થયું નહોતું.

આવી આયુરોધીય શાસ્કિયા બદલે સરકાર તરફથી  
તેમને ‘શાલ્ય ચિકિત્સક’ નું પ્રમાણપત્ર પણ મળેલું.

**૫. રેચુકમ:** રેચુક એટલે રેચ કરનાર. અથવા વિરે-  
ચણ, લોકલાષામાં રેચકનો અર્થ થાય છે જાડા કરનાર,  
મળશુદ્ધ કરનાર, ઉપરાંત આયુરોદમાં રેચકનો ખાસ અર્થ

થાય છે પિતવિરેચક, તે શિરોવિરેચન ગુણુથી માથાના કેંકનું પણ રેચન કરે છે (-સુશ્રુત). શિવામ્બુને મૂત્રલ ગુણું પણ મૂત્ર વિરેચક ગુણને કારણે ગોમૂત્ર વગેરે મૂત્રનો વિરેચન તરીકે કબજીયાત, પાંકુ, જળોદર, સોઝ વગેરેમાં ઉપયોગ કરવાની પ્રથા ખૂબ પુરાણી અને પ્રયક્ષિત છે. કહેવાય છે કે ગોમૂત્રને જેટકી વખત કપડાથી ગાળીએ તેટલા રેચ થાય છે, શિવામ્બુના પણ તે પ્રકારના અનુભવો કરવા જોઈએ. પાંકુ, કમળા, કબજીયાત, ઉદરરોગ, પુષ્કળ પિત વગેરેમાં મૂત્રનું વિરેચન હિતાવહું બને છે. મારા એક ડોકુટર મિત્ર જ્યારે જ્યારે શિવામ્બુનું સેવન કરે છે ર્થારે તેમને પુષ્કળ ઝાડા થઈ જય છે, તે તેના રેચન ગુણુથી જ. શિવામ્બુ પોતાના આ ગુણુથી જૂની-નવી કબજીયાતને દૂર કરે છે.

યોગરતનાકરે 'પિતરકૃતકુમિહર' રેચનં... કણું છે તો અષ્ટાંગ સંગ્રહમાં 'પિત પ્રવૃદ્ધ' ચ નિયર્ઘતિ કહેલ છે, તેની મોટી માત્રામાં સેવન કરવામાં આવે તો વધી ગયેલા પિતને (રેચક ગુણુથી) બહાર કાઢે છે.

નિધાંકુઠારોએ શિવામ્બુને '(પિત વિરેચક' અથવા 'પિત સંશોધક' પણ કહેલ છે.

\*

ડૉ. પાચનમ-દીપનમઃ રાજનિધાંકુમાં 'નરાણાં  
તું અવેત પાચન' દીપન' લધુઃ। બધી જ જતનાં

(ખ્રી-પુરુષ-ખાળક સૌનાં) મૂત્ર પાયન કરાવનારાં અને ભૂખ લગાડનારાં છે.

શાલીઓમાં નિધંદુમાં અને હારિત સંહિતામાં પણ શિવામ્બુનો દીપન ગુણું દર્શાવ્યો છે. શિવામ્બુ કદુસ્કંધનું દ્રવ્ય હોવાથી તેમાં તીઘેા, ખારો, કડવો રમ્ન અને ક્ષારીયતા હોવાથી, ઉષણું-તીક્ષણું હોવાથી, ઉષણું વીયું અને કદુ વિપાકી હોવાથી પાયન-દીપન છે. તનો પિત્તવર્ધક શુણું પણ પાયકાળિને વધારીને ભૂખ-પાયન વધારે છે. તેમાં બહુતને ઉત્તેજિત કરવાનો ગુણું છે તેથી શિવામ્બુ સેવન કરનારને બેન્દું દિવસમાં જ સખત ભૂખ લાગવા માંડે છે અને જે ખાય છે તે પચી જથું છે. એટલીકંઈ-કિને તો એટલી બધી ભૂખ લાગે છે ને એટલું બધું પાયન થાય છે કે જીવનમાં કચારેય તેજો તેટલું ખાદું ન હોય ! શ્રી નટવરલાલ માળવીએ ‘મારો શિવામ્બુ પ્રયોગ’માં આ ગુણનું સરસ વર્ણન કર્યું છે.

\*

૭. રસાયનમ્ : ‘યદુ જરાવ્યાધિનાશન’ તરફથી રસાયનમ્-ને ધડપણ અને રોગનો નાશ કરે છે તે દ્રવ્યને રસાયન દ્રવ્ય કહેવાય છે. રસાયનનો સીધો અર્થ છે રસનું અયન. આખા શરીરને પોષણ આપતા ડોષનું નવસર્જન કરતી રસ-રક્તાદિં દ્રવ ધાતુએ આખા થી શરીરમાં સતત ‘અયન કરે છે. રસાયન ગુણવાળું દ્રવ્ય રસના અયન એટલે રસના પરિભ્રમણને સતત અને

વ્યવસ્થિત ચાલુ જ રાખે છે. જેથી શરીરના પોષણમાં, નવા ડેઅ થવામાં કચાંય ખલેલ પહેંચતાં કે અવરોધ પેહા થતાં રોગ અને વૃદ્ધત્વ આવે છે જેને તે દૂર રાખે છે. 'રસ' શાખથી રસાદિ સાતેથ ધાતુઓનો સમાવેશ કરી શકાય. આ સપ્ત ધાતુઓનું અધ્યન (મેટાયોલિઝમ) બરાબર થયે કરે તો શરીરને પોષણ હેઠળાં જળવાઈ રહેતાં વાયુ નથી વધતો. 'શીર્ય'ને ક્ષરણાત શરીરમ, ધસાવાના સતત ગુણથી જે હિન-પ્રતિહિન ધસાતું જન્ય છે, નાશ પામતું જન્ય છે તે શરીર' એવી જેની વ્યાપ્યા છે તે શરીરનો ક્ષય ન થતાં 'જેસે થે' રહે છે. રસાયન ગુણનો લાભ મળે તેને અંશાં કેવળ ધડપણું દૂર થાય છે એટલું જ નહીં તેને સ્મૃતિ, બુદ્ધિ, મેધા, પ્રભા, કાન્તિ, ઉત્સાહ, બળ, સ્વર, શાન, દાઢિ, વૃષ્યતા, આરોગ્ય, પ્રતિકાર શક્તિ, સાર્વિકતા, પ્રસંગતા વગેરે પણ પ્રાપ્ત થાય છે.

શિવામણુઠદ્વપમાં અમુક મહિના કે અમુક વર્ષ સુધી શિવામણુસેવન કરવાથી કે અમુક અનુપાન સાથે શિવા-મણુનું સેવન કરવાથી રસાયન ગુણ મળે છે તેવા અનેક કલોકા છે જેમાંના થોડાંક નમૂના ઇથે :

-શિવામણુ ચામૃતં દિવ્યं જરારોગ વિનાશનમ् ॥૧૮  
શિવામણુ અમૃત સ્વરૂપ, દિવ્ય ગુણવાળું અને ધડપણું તથા રોગાના વિનાશ કરનારું (રસાયન) છે.

-હરીતકીભવં ચૂણું લક્ષયેતુ પ્રયોગતः ।  
શિવામણુપાનકે કુર્યાજજરારોગ વિનાશમ् ॥ ૨૪

હરદેનું ચૂણું ખાઈને ઉપર શિવામ્બુ પીવાનો એક  
વર્ષો સુધી પ્રયોગ કરવાથી ઘડપણ અને રોગયો વિનાશ  
થાય છે (એટલે કે રસાયન ગુણું પ્રાપ્ત થાય છે.)

-મધૂકં ઇલખીજં ચ ત્રિદ્વલાસમલાગત : ।

ભક્ષયેદ્ નશં તેન જરારોગક્ષયં ભવેત ॥૩૫.

જેઠીમધ (‘મધૂક’નો અર્થ બહેડાં પણ થાય છે.) અને  
ત્રિદ્વાનું ચૂણું સમલાગે મેળવી રોજ રાત્રે લેવું (અને  
સવારે શિવામ્બુપાન કરવું) તથી ઘડપણ અને રોગનો ક્ષય  
થાય છે. (રસાયન ફળ પ્રાપ્ત થાય છે.)

-શિવામ્બુ કદ્વની મોટા લાગની ફળશ્રુતિએ રસાયન  
ગુણું રૂપે છે. જેમ કે દીર્ઘાયુષ્ય, આરોગ્ય, સ્મૃતિ, યુક્તિ,  
મેધા, પ્રજ્ઞા, સ્વર, ડાન્ત, બળ, વૃષ્યતા, વિશિષ્ટ શક્તિ  
વગેરે.

સ્વમૂત્રપ્રાર્થન કરનારા યોગીએ સો-હોઢસો વર્ષો સુધી  
જીવી શકે છે એના ઉદ્ઘાંરણો મિ. આર્મસ્ટ્રોઝને પોતાના  
હિમાલયના પ્રવાસ દરમિયાન નજરે જેવાં મળ્યાં હતાં.

શિવામ્બુ કે ટોઈપણું રસાયન દ્વયમાં રહેલો રસાયન  
ગુણું ત્યારે જ ફળ આપે છે કે જ્યારે રસાયન ગુણું મેળ-  
વવાની લાયકાત હોય. ચરક સંહિતા (અધ્યાય ૧-૪,  
શ્લોક-૭૭)માં એ લાયકાત આ પ્રમાણે વર્ણવી છે :

(યોગ્યા ખાયુપ્રક્રષ્ટિં જરારોગનિષ્ટ્રોધ્યાઃ ।

મનશરીર શુદ્ધનાં સંધ્યાનિત પ્રયત્નમનામ ॥

વૃદ્ધત્વ અને રોગોને દૂર કરનાર રસાયન યોગો પ્રયત્ન

કરવાથી એવી વ્યક્તિને સિદ્ધિ આપે છે કે જેનું મન અને શરીર શુદ્ધ હોય અને પોતાના મન ઉપર સંયમ હોય.

સંયમી લોકને રસાયન પ્રયોગ સિદ્ધિ આપે છે/તેવું જરૂરાવતું એક આયુર્વેદીય સૂત્ર આ પ્રમાણે છે.

**શાસ્યાણામન્યકાર્યાણાં સિદ્ધયત્ય પ્રયત્નમનામ् ।**

ડોઈ પણ રસાયન પ્રયોગ ગૃહસ્થજીવનમાં ઇસાયેલા, અહિચ્ચેનું પાલન નહીં કરનારા અને અસંયમી લોકને સિદ્ધિ આપતો નથી.

અને એટલે શિવામ્બુ પ્રયોગ યોગી, સાધુ, સંન્યાસી કે અહિચ્ચારીઓ વધારે કરતા. પણ જે સામાન્ય ગૃહસ્થ લોકને રસાયન ગુણની વિશિષ્ટ સિદ્ધિ મેળવવાની જરૂર નથી કે ઘણા પણ નથી હોતી તેઓ સામાન્ય કાયદો મેળવવા માટે પણ પોતાનાથી શક્ય તેટલા સંયમી રહીને સેવન કરી શકે. ગૃહસ્થી લોકા શિવામ્બુ પ્રયોગને કાયદું નથી તેવો અર્થ અહીં કરવાનો નથી. તેમને ઇણ એછું મળે, વિશિષ્ટ ઇણ ન મળે તેવો અર્થ કરવાનો છે.

આયુર્વેદે ગાય, બકરી, હાથી વગેરે આડ-દસ પ્રાણીનાં મૂત્રના ગુણ વર્ણિત્વા છે તેમાં ડોઈને રસાયન ગુણવાળું કહેલ નથી. કેવળ એક માનવમૂત્રને જ રસાયન ગુણવાળું કહ્યું છે એનો અર્થ એ થયો કે બધાં જ મૂત્રમાં માનવ-મૂત્ર શેષ છે.

શિવામ્બુમાં રસાયન ગુણ હોવાનો શાસ્ત્રીય સંદર્ભ જોઈએ.

-કૈયહેવ નિધંડુમાં (કલોક નંબર-૪૪૮)-

નરમૂત્ર કદુક્ષાર વિપદ્ધન ચ રસાયનમ् ।

કૈયહેવ નામના મહાવૈદ્ય ગુજરાતમાં થઈ ગયા. તેમણે ૧૪૫૦માં પોતાનું કૈયહેવ નિધંડુ પ્રગટ કરેલું. કદાચ શિવામ્બુનો 'રસાયન' ગુણ તેમણે સર્વ પ્રથમ ગુજરાતીમાં અન્થસ્થ કર્યો હોય.

-મહનપાલ નિધંડુમાં (કલો. નં. ૨૧૭)-

નરમૂત્ર ગર હંત સેવિત સુરસાયનમ् ।

માનવમૂત્ર વિષને હણે છે અને નિય સેવન કરવાથી તે સુરસાયન (ઉત્તમ રસાયન) ગુણ આપે છે.

ભાવપ્રકાશ નિધંડુમાં 'તદ્ર રસાયનમ्' શાખદ છે તો મહનપાલ નિધંડુમાં સુરસાયનમ्.'

-ભાવપ્રકાશ નિધંડુમાં (પૂર્વખંડ મૂત્રવર્ગ-૬)-

નરમૂત્ર ગર હંત સેવિત તદ્ર રસાયનમ् ।

વૃદ્ધત્વથી અને લઘુત્વથી એમ આયુર્વેદના મુખ્ય છ અન્થેમાં ભાવપ્રકાશ સંહિતાનો સમાવેશ છે. સોળમી સદીમાં આ અન્થ લખાયો હતો.

આ અન્થમાં કેવળ ગોમૂત્ર અને નરમૂત્રના ગુણ આપેલા છે તે પ્તાવે છે કે ત્યારે નરમૂત્રને મહરવ મળેલું હતું.

-નિધંડુ રતનાકરમાં-

નરમૂત્ર રેચક સ્થાત ક્ષાર ચોણુ રસાયનમ् ।

માનવમૂત્ર રેચક છે, ક્ષારીય છે, ગરમ છે અને રસાયન છે.

## ૦ શિવામ્બુ...રોગહરત્વની ફળિએ—

આયુર્વેદના અનેક અન્થોમાં સીધા અને આડકતરી રીતે અનેક રોગોને મટાડવાનો ઉદ્દેખ છે.

—**કુકુજીન્યરોગો :** શિવામ્બુ કુકુજન છે તે વાત આગળ કહેવાઈ ગઈ તેથી તે કુકુજના ૨૦ જલના રોગોને મટાડે છે. એટલે કે કોઈ પણ કુકુજીન્ય રોગમાં શિવામ્બુ પૂણુ નિઃસંક્રાય આપી શકાય.

—**વાતજીન્ય રોગો :** શિવામ્બુને વાતજન પણ કહેલ છે તે પણ આપણે આગળ તપાસી લીધું. ૮૦ પ્રકારના વાયુના રોગોમાં પણ શિવામ્બુ નિભયપણે વાપરી શકાય.

—**પિતજીન્ય રોગો :** આગળ જોયું તેમ શિવામ્બુ ઉણુ, તીક્ષ્ણુ, ખાડું તીખું વગેરે હોવાથી પિતવર્ધક છે. છતાં અનુભવે ધળું ઐતિક રોગોને પણ તે મટાડે છે. માટી માત્રામાં વિરચનિપે શિવામ્બુ પીવાથી પિતનું વિરચન થઈ પિત બહાર નીકળી જય છે. છતાં કેવળ પિતના ૪૦ રોગોમાં શિવામ્બુનો પ્રયોગ વિચારીને કે ડોઈ જાળુકારના માર્ગદર્શન હેઠળ કરવે!. અને માઝક ન આવે તો બંધ કરવો.

વાયુ-પિત-કુકુજના તમામ રોગોને મટાડવાનો ગુણ દર્શાવતો આ શિવામ્બુકદ્વપનો શ્લોક (૮૧-૮૨) ખાસ અહીં ઉદ્દેખનીય છે.

वसंतकाले हेवेशि ! क्षोद्रयुक्तां हुरीतकीम् ।

प्रार्थ विश्वौषधं तद्वत् पश्चात्पानं शिवाम्बुनः ।

विशतिः श्लेष्मरोगाणां चत्वारिंशत्य ऐतिकाः ॥

अशीतिर्वातजन् रोगान् नश्यन्ते नात्र संशयः ।

हे हेवी पावैती ! वसंतऋतुमां हुरडे अने सूर्ठनुं  
चूणुं समलाग लट्ठ (२ थी ४ आम) भधमां चाटवुं अने  
उपर शिवाम्बु पीवुं तेथी कळना २०, पितना ४० अने  
वाढुना ८० रोगो मटे छे तेमां शंकाने स्थान नथो.

—आमजन्य रोगोः : अगाउ यर्या थया प्रसाणे  
शिवाम्बु आमद्वन्हे वाथी आमजन्य अधा रोगोमां खुब  
४ जाईक आवे छे. आयुर्वेदनी समज प्रमाणे आम  
अधा ४ रोगोनुं मूण हेवाथी साम अवस्थाना वायु—  
पित-कळमां शिवाम्बु सारुं परिणाम आपे छे. आमनुं  
प्रसाण वधु हेवाय तेवा जूना-४ठिल रोगोमां लंघन साथे  
शिवाम्बुप्रयोग वधु कामयाअ अने छे. कारणु के लंघन  
पणु निरामीकरणु करवा माटे उतम संशमन किया छे.—  
लंघनं परं औषधम्.

—विषजन्य रोगोः : शिवाम्बुना विषद्वन् गुणनुं  
वर्णन वधुमां वधु आयुर्वेदीय ग्रन्थामां थयेलुं छे. ए  
आ प्रमाणे छे :

१. सुश्रुत संहिता (ला. १, अ, ४५, २ला. २२८)

२. स. पूर्वे हज्जरेक वर्षे लभायेली सुश्रुतसंहितामां  
मूत्रं मानुरं च विषापहम् ।—मानवमूत्र विषनाशक

છે.' તેથું સવિશેષ કહેવાયેલું છે.

અહીં વિષને વિશાળ અર્થમાં લઈ શકાય, તે રાતે ગરવિષ (કૃત્રિમ જેર), દૂષીવિષ (શરીરમાં જૂનું થયેલું જેર), સ્થાવર વિષ (સોમલ, અશીણુ વગેરે), જંગલ વિષ (સપ્ચ, વોંધી, હડકાયાનું વિષ વગેરે), આહાર વિષ, પ્રદૂષણજન્ય વિષ, હવામાં ભણેલ વિષ, પાણીમાં ભણેલ વિષ વગેરેને માનવમૂત્ર મટાડે છે.

મૂત્રમાં હૃદય (હૃદયનું રક્ષણુ હુરનાર, હૃદયને બળ આપનાર) ગુણ હોવાથી જેને જેર ચડવાનું શરીર થનું હોય તેને અથવા જેર ખાવામાં આવી જતાં કે તેનો ડંખ થતાં તુરત વિષનો પ્રતિકાર કરવા સદ્ય સ્વમૂત્ર પાઈ દેવાનું પણ સુશ્રુત સંહિતામાં દહેવામાં આવેલ છે.

૨. અષ્ટાંગ સંગ્રહ (વૃદ્ધ વાજભાઈ) (સૂત્ર, મૂત્રવર્ગ ૬/૧૪૭) 'માનુષ મૂત્ર વિષાપહુમ' અથવા 'માનુષ તુ વિષાપહુમ'-માણસનું મૂત્ર વિષદ્વન છે. આ ગ્રન્થ પણ અતિ પુરાણો છે.

૩. ભાવપ્રકાશ (પૂર્વખંડ, મૂત્રવર્ગ, શ્લેષક-૬) 'નરમૂત્ર ગર હુનિત'-નરમૂત્ર કૃત્રિમ જેરને મટાડે છે. અહીં જેરના ધણા પ્રકારમાંથી કૃત્રિમ વિષ (ટોકિસન્સ)ને ખાસ મટાડવાનો ગુણ દર્શાવ્યો છે. આજના યુગમાં આવા વિષનું પ્રમાણુ વધારે છે અને તે કારણે રોગોનું પ્રમાણુ પણ વધારે હોવાથી આજે તો શિવામ્બુ-સેવનનું મહત્વ અનેકગણું વધુ સમજવું જોઈએ.

## શિવાભ્યુસેવન

૪. યોગરત્નાકર-૮૬૦ (મૂત્રાષ્ટકમ् શલોક નં. ૧૧)

માનુષં તું વિષાપહુમ.

૫. ધન્યવન્તરિ નિધંડુ-(છૃંગ વર્ગ)

માનુષં તુ વિષાપહુમ.

૬. કૈયદેવ નિધંડુ-(પાનું-૪૦૦)

નરમૂત્રં કદુ ક્ષારં વિષદનં ચ રસાયનમ.

૭. શોદ્ધલ નિધંડુ-(મૂત્રવર્ગ શલો. ૮૬૦)

માનુષં વિષજિત મૂત્રમ.

૮. મહનપાલ નિધંડુ-(શલોક નં. ૨૧૭)

નરમૂત્રં ગરં હુનિં...

(લાવપ્રકાશ પ્રમાણે ૭)

૯. શાલિઆમ નિધંડુ-

વિષૂચિકા વિષનાશકમ्, માનુષં વિષજિત...

૧૦. નિધંડુ રત્નાકર-

વિષં ચ આમં કૃમ્યસ્તથા.

શિવાભ્યુ વિષ, આમ તથા કૃમિને મરાડે છે.

૧૧. લૈષજથ રત્નાવલિ-

આ ગ્રન્થમાં શિવાભ્યુને 'વિષવજ્જપાત રસ' નામના વિષનાશક ઔષધના અનુપાન તરીકે શિવાભ્યુનો ઉપયોગ કરવાનું આ રીતે કહ્યું છે. 'હળદર, ટંકણ, જવંતી અને મોરથૂથું'ને સમાન લાગે લઈ પીસીને કુકડવેલતા રસમાં

ખરલ કરી ૧ અભાની ગોળી બનાવવી આ ગોળી ૧. માત્રામાં ઘરરાવી ઉપર અને તેટલું વધુ સ્વમૂત્ર પાવાથી સૃત્યુના મુખમાં ધકેલાઈ ગયેલા વિષાક્તા દરદીને બચાવી લે છે.

આવા શાસ્ત્રીય અન્થો ઉપરાંત તે પણી લખાયેલા અનેક અન્થોમાં વિષ [ચિકિત્સા]પે શિવામ્બુને આંતરબાળ ઉપયોગ દર્શાવેલો છે. લોડોમાં પુણુ વારસાગત અનેક ઉપાયો છે. થોડાક નમૂનાઓ :

ગોમૂત્રૈન્રમૂત્રૈર્વા પુરાણેન ઘૃતેન વા ।

હરદાપાનમાત્રેણ વિષં હુનિત ચરાચરમ् ॥

‘ઝાંખીકેશ પંચાંગ’માંથી

માત્ર ગોમૂત્ર, માનવમૂત્ર, જૂનું ધી કે હળદર પાવાથી ચર્ચ-અચર (જાંગમ કે સ્થાવર) વિષ નાશ પામે છે.

ચલેણમણુઃ કણ્ણગૂથસ્ય વાસાનામિકયા કૃતા ।

લેપા હુન્યાત વિષં વોરં નુમૂત્રસેવનં તથા ॥

મેંમાંથી નીકળતા કરનો કે ડાબા હાથની ટચલી આંગળી પાસેની આંગળી વડે કાનમાંથી કાઢેલો મેવનો દંશ ઉપર લેપ કરવાથી અથવા દંશ ઉપર સ્વમૂત્ર કે માનવમૂત્રનું સિંચન કરવાથી (ધાર કરવાથી) લયંકર જેર જિતરી જન્ય છે.

—ગીરના જાંગલમાં રહેતા સાધુ-સન્યાસીઓ સંપુર્ણ-વિષમાં પોતે શિવામ્બુ પીએ છે અને અન્યને પીવાનું આંધે છે.

## શિવાસ્થુસેવન

—વાદી લોડા સર્પવિષ ઉતારવા માટે સ્વમૂત્ર પીએ છે ન રહે છે.

—સર્પ અને ખાસ કરીને ભાલુપ્રદેશમાં પશુઓને સર્પ કરું ત્યારે ગાય કે બળદનું મૂત્ર પિવરાવે છે ને તેના પાઠા બાંધે છે.

—સાપ સાથે યુદ્ધે ચરેલો નાળિયો ધાયક થાય ત્યારે પોતાનું મૂત્ર પીએ છે ને મૂત્રમાં આગેટે છે. તેથી તેને સર્પવિષની અસર થતી નથી અને સાપને ભારી શકે છે.

—બાવચીને સાત દિવસ સુધી ગોમૂત્રની ભાવના આપી તેનું ચૂર્ણ કરી ૨-૨ ત્રામ આપવાથી ઊર જિતદે છે. અહીં ગોમૂત્રને બદલે સ્વમૂત્ર કે ડેઈપણ અન્ય નર-મૂત્ર ચાલે. પાતી વખતે ઔષધના અનુપાતમાં સ્વમૂત્ર જ પિવરાવવું.

ઉપર કલ્યા પ્રમાણે વિષની સારવાર આયુર્વેદના ગ્રન્થોને અને તેના ઉપરથી પરંપરિત રીતે પ્રયલિત છે. તે પ્રમાણે વિષનો પ્રતિકાર કરવા માટે-વિષને ચડતું રોકવા માટે કુટેની કશી અસર ૩ શરીર પર ન થાય તે માટે પણ શિવાસ્થુનો ઉપયોગ દર્શાવાયો છે. શિવાસ્થુમાં વિષ-પ્રતિરોધક ગુણ સારા પ્રમાણમાં હોવો જોઈજો. કારણ કે જે વ્યક્તિ લાંઘે સમય શિવાસ્થુનું સેવન કરે છે તેને સાપ, વીંછી કે અન્ય વિષ ચડતું જ નથી! શિવાસ્થુકલ્પમાં આ ગુણનું વાર-વાર પ્રતિપાદન કરવામાં આવ્યું છે.

भाद्र्यते नैवं सर्पद्यि विषाद्यैर्न् विहित्यते । २१  
शिवाभ्युपाननो यार वर्षं सुधी प्रयोग करवामां  
आवे तो ते व्यक्तिने सर्पं वगेरे जेरी ज्वेा कशी बाधा  
करी शक्ता नथी एटले के तेनुं जेर तेने चडतुं नथी के  
डोर्ड पणु जेरी जंतु के जेर तेने भारी शक्तुं नथी.

डेवળ हंशजन्य विष ज नहीं, पणु वधी गयेला  
अन्य विषो जेवा के वायुविष (वायरस), औषधविष,  
आहारविष, जगविष, काणविष, अणुविष, आमविष,  
प्रदूषणविष वगेरे आजना युगमां भुष्टण वधी रखां छे ने  
रोगकारक भनी रखां छे तेमां शिवाभ्यु ज्वरदार प्रतिकार  
शक्ति आपी शक्ते तेम छे.

**—पामा (भस) :** शिवाभ्यु भस अने तेमांय ते  
राती भस मटाडवामां सर्वोत्तम औषध छे, तेना आंतर-  
बाल्य उपयोग करवाथी आश्वर्यजनक परिणाम बतावे छे.  
अष्टांगसंग्रहमां डेवળ ‘पामाहर’ कहेक छे तो भावप्रकाशमां  
‘रक्तपामाहर’ कहीने ते एक रोगने ज खास महरवा  
आपवामां आव्युं छे.

**—चक्षुरोग (आंखना वधा ज रोगा) :** हारित  
संहिता, अष्टांग संग्रह अने शास्त्रियाम निधंदुमां वधा  
ज नेत्ररोग मटाडवा शिवाभ्युनो आंतरबाल्य उपयोग  
करवानुं विधान छे.

**कुमि :** अष्टांग संग्रह, योगरत्नाकर, अने निधंदु रत्ना-  
करमां शिवाभ्युनो कुमिहरणु गुणु कह्यो छे.

—મોહ : મોહ એટલે મૂર્ખાં અથવા અતિ જિંધ. શિવામ્બુ કફીબન હોવાથી અને સાત્ત્વિકતાથી તેને દૂર કરે છે. જેર ચડવાને ઢારણે થતા મોહમાં તેનું પાત અને નસ્ય એ ઢારણે હિતાવહ બને છે.

—રક્તપિતા : યોગરત્નાકરમાં શિવામ્બુને। એક ગુણ રક્તપિત ભટાડનારો પણ કહ્યો છે. કેટલાઈ તે શાખદનો ‘પિત રક્ત’ અથ્ર કરી પિતના અને રક્તના રોગોને શિવામ્બુ ભટાડે છે તેમ કહે છે. રક્તપિત એટલે શરીરના ડાઈ પણ દ્વારમાંથી લોહી વહેવું. નસ્કોરી કૂટની, દાંતમાંથી લોહી આવવું, મેં દ્વારા લોહીની ભિકટી થવી, લોહીના જાડા અને લોહીના પેશાબ થવો વગેરે રક્તપિતનાં લક્ષણો છે. શિવામ્બુ ગરમ હોવા છતાં આવા ગરમ રોગને પણ ભટાડે છે તે તેની વિશેષતા છે.

—રક્તહોષ : રક્તહોષ એટલે લોહી બગડવું. લોહી બગડવાથી ખણું ચામડીના રોગો, અરુચિ, શરીર કાળું પડવું, ઘેન રહેવું વગેરે થાય છે તેમાં શિવામ્બુને આંતરભાવ્ય રૂપે યોજ શકાય.

—પ્રણા : નિધંડુ રત્નાકરમાં શિવામ્બુને પ્રણને ભટાડનાર કહેલ છે.

—ત્વચારોગો : ચામડીના બધા રોગો એટલે તે કુઝઠ રોગોને ભટાડવાનો સવિશેષ ગુણ શિવામ્બુમાં છે તે સુવ્યવિદ્ધિત છે. ધોળા ડાઢ, ખંજવાળ, ખસ, દાદર, ખરજવું, ગૂમડાં, સોસયસીસ, ઝોડખી, ખીલ, કરેળિયા વગેરેમાં

શિવામ્બુદ્ધો આંતર-ભાગ્ય ઉપયોગ કરવો જોઈએ. રાતી ખસમાં તો તે સર્વોત્તમ છે.

—**ભૂતભાધા** : વળગાડ, ગ્રહભાધા, ચેપ્પીરોગો, જંતુ જંય રોગો, આજની ભાગામાં કહેવાતા વાયરસજન્ય રોગો, અતરવાલિનિવેષ વગેરેમાં પણ શિવામ્બુદ્ધો આંતર-ભાગ્ય ઉપયોગ અજમાવવા જેવો છે. નિધંડુ રત્નાકરમાં આ ગુણ વર્ણિતો છે.

—**વિષૂચિકા (કાલેરા)** : શાલિયામ નિધંડુમાં શિવામ્બુદ્ધો કાલેરાનો ઉપાય કહી તેને ઈમજંસી ઔષધ તરીકે સ્થાપિત કરેલ છે. જાડા-જિલ્લામાં પણ તે કારણે ઉપયોગી થઈ રહે.

\*

### ૦ સર્વ મૂત્રના સામાન્ય ગુણ —

શાકાહારી અને પાણેલાં આઠ પ્રાણીનાં મૂત્રનું વર્ણન પ્રાયઃ આયુવેદીય તમામ ગ્રંથીમાં આપવામાં આવેલ છે. મૂત્રવર્ગને એક સમાન ગણી વિશેષ ગુણ ઉપરાંત સામાન્ય ગુણો! પણ આપવામાં આવેલા છે. ‘મહનપાત્ર નિધંડુ’માં તો એ બધાં જ મૂત્રના સામાન્ય ગુણની સાથે સાથે નરમૂત્ર (માનવમૂત્ર)ને પણ વર્ણિત્વું છે જેના શ્લેષ્ટા અતિ ઉપયોગી હોવાથી અહીં રજૂ કર્યા છે.

મૂત્ર જોનાગમર્હિષાહ્યજાવિઘરેષ્ટ્રજમ્બ ।

નરાણાં ચ જીવેતસર્વ પાચન દીપત લધુ ॥ ૨૦૦  
લવણાનુરસ તિક્ટ રુક્ષ સ્ફોતાવિશોધનમ ।

પિતાં કદુક હૃદાં સેહિ વાતાનુલોમનઃ ॥ ૨૦૧  
તિખુનિતિ વાતગુદમાર્શઃ શોક્ષેદર કરુંદિમીન् ।  
કુષ્ઠપાંકુગદાનાહુવિષશૂલાનુચિસ્તથા ॥ ૨૦૨

ગાય, હાથી, લેંસ, બોડા, બઠરાં, ઘેટાં, ગઘેડાં, જાંટ  
અને મજુષ્ય એ બધાંનાં મૂત્ર અન્તનું પાચત કરાવનારાં,  
ભૂખ લમાડનારાં અને પચવામાં હળવાં છે. આ બધાં મૂત્ર  
અનુરસમાં ખારાં, કડવાં, લૂખાં અને સ્લોતોને ચોખ્ખાં  
કરનાર છે. તે પિત કરનારાં, તીખાં, હૃદયને હિતકારી  
અથવા હૃદયને પ્રિય ગુણવાળાં, મળનું કે દોષોનું લેદન  
(તાડીને બહાર ધકેલવાના ગુણવાળા) કરનારાં, તેમજ  
વાખુની ગતિને સવળી કરનારાં છે. આ બધાં જ મૂત્ર વાયુ  
(વાયુના બધા રોગો), ગોળા, હરસ, સોંભ, ઉદરરોગ  
(જાગોદર, લીવર-અરોગ્યનો સોંભે વગેરે અથવા બધા જ  
પેટના રોગો), કંક (કંકના બધા રોગો), કુમિ, કોણ, પાંડુ,  
આનાહ(પેટ વાયુથી ઝૂલવું), વિષ, શૂળ (બધી જ જાતના  
દુઃખાવા) તથા અરુચિનો પણ નાશ કરે છે.

આ ઉપરાંત ધન્વન્તરિ નિધંડુ, કૈયહેવ નિધંડુ, સોદ્ધસ  
નિધંડુ, અષ્ટાંગ સંગ્રહ, સુશ્રુત સંહિતા, અષ્ટાંગ હૃદય  
વગેરે અન્યોમાં મૂત્રના સામાન્ય ગુણ દર્શાવ્યા છે. તેમાં  
નીચેના રોગો મટાડવાનું કહેલ હોવાથી સામાન્ય મૂત્રમાં  
નરમૂત્રનો સમાવેશ થતો હોવાથી નીચેના રોગો પણ  
શિવામ્બુથી મટી શકે છે તેવો અર્થ કહી શકાય. તો  
ઓગળ કહેલા ઉપરાંત મદનપાલ નિધંડુમાં કહેલા સહિત  
નીચેના રોગો પણ શિવામ્બુથી મટી શકે છે.

૧. અરુચિ : અરુચિ અથવા અરોચક રોગમાં ભૂખ લાગતી નથી. શિવામ્બુ કંકણ, તીખું, ખાડું, કડવું, હળવું, પાચન, દીપન, ભેદન, અનુલોભન, વિરેચન, રુચિકર, આમપાચક, ઉષણ, તીક્ષણ, વગેરે ગુણુકમ્ભ્યી અરુચિ નામના રોગને મટાડે છે.

૨. આનાહ : આનાહ એટલે આકૃરાને મળતો રોગ. તેમાં પીડા થયા વિના પેટ કૂદેલું રહે છે. પેટમાં જેસ લરાય છે. શિવામ્બુ વાતણ, ઉષણ, તીક્ષણ, અનુલોભન, વિરેચન, શોધન, ભેદન, પાચન અને ક્ષારીય હોવાથી આનાહને મટાડે છે.

૩. ગોળો (ગુદમ) : ઉપરોક્ત ગુણુકમ્ભ્યી શિવામ્બુ ગોળાને પણ મટાડે છે.

૪. જઠરરોગ (ઉદ્દરરોગ-પેટના રોગ) : જણોદર, બુદૃતોદર, ખીણોદર વગેરે ઉદરરોગને શિવામ્બુ મટાડે છે. ઉપરાંત પેટનાં એટલે કે આંતરડાનાં તમામ દર્દોમાં પણ તે વાપરી શકાય. ઉપર કહેલા ગુણુથી તે પાચનતંત્રના તમામ રોગોમાં ઉપયોગી થઈ શકે.

૫. પાંડુ : પિતવિરેચક, શોથણ, પાચન, દીપન, શોધન, ભેદન, હંદ્ય, બદ્ધ, તિક્ષણ વગેરે ગુણો અને રસોથી શિવામ્બુ પાંડુને મટાડે છે.

૬. મેદ : મેદ એટલે ચરખી વધવી વજન વધવું. શિવામ્બુ કંકણ, કડવું, તીખું, હળવું, ઉષણ, તીક્ષણ, ઇક્ષ, રેચણ, ક્ષારીય, ભેદન, શોધન વગેરે ગુણુથી મેદને ઘટાડે છે.

૭. વર્દ્ધમ્ભી : વર્દ્ધમ્ભી એટલે વરાધ. વાતંન, ક્રીડન,  
અનુદોમન, શોધન, ભેદન, ખારું, ગરમ, તીક્ષ્ણ, આમ-  
પાયક, ક્ષારીય વગેરેથી વરાધ એટલે કે બાળકોની સસ્તણી  
મટાડે છે.

૮. ચિત્ર : સર્વેદ દાગ અથવા ધોળા કોણ નામે ખૂબ  
જ વ્યાપક ચર્મરોગ પણ શિવામ્બુ સેવનથી મટી રહેતે માં  
દૈયદેવ નિધંડુ, આણાંગ સંગ્રહ અને શોઢન નિધંડુનું કહેવું  
છે. તેને આંતર-બાધ ઉપયોગ કરી શકાય.

૯. શૂલ : શૂલ એટલે હુઃખાવો, પેર્ઠન, શૂળ નીકળવું.  
સર્વાંગ, એકાંગ કે ઉપાંગમાં થોડા કે વધુ હુખાવો થાય  
તેને શૂલ કહેવાય છે. ('ન વાતેન વિના શૂલમ्-વાયુ વગર  
શૂળ નહીં') એ સૂત્ર અનુસાર શિવામ્બુમાં વાયુનાશક ગુણ  
હોવાથી તે શૂળને મટાડે છે. પીવાથી અને ગરમ અફ્યંગ,  
સેચન, ઉપનાડ વગેરેથી. શિરઃશૂળ, ઠર્ણશૂળ, દ્રષ્ટાશૂળ,  
ઉરઃશૂળ, હૃદયશૂળ, સાંધિશૂળ, કટિશૂળ, પિંડિશૂળ, સ્નાય-  
શૂળ, અસ્થિશૂળ વગેરે બધી જ જાતના હુખાવામાં શિવામ્બુ  
વાતંન, ઉણુ, તીક્ષ્ણ, ખારું, ક્ષારીય, અનુદોમન, બૃહ્ય,  
હૃદ્ય, ભેદન, શોધન, આમપાયક, સોતો વિશોધન વગેરે  
ગુણથી પરિણામદાયી બને છે.

૧૦. સોણ : શોથ એટલે કે સોણના મુખ્ય બે પ્રકાર  
કેઝ શોથ અને વાતજ શોથ શિવામ્બુથી ખાસ મટે છે.  
મૂત્રવિરેચક, ભેદન, શોધન, અનુદોમન, સોતોવિશોધન,  
ક્રીડન, વાતંન, તીણું, ગરમ, તીક્ષ્ણ, લધુ, આમદન વગેરે

ગુણથી સોજી મટાડે છે. બાલ્ય ઉપચાર રૂપે શિવામણુનાં  
પોતાં મૂકી શકાય. પિતજન્ય સોજીમાં પણ મોટી માત્રામાં  
પિવરાવવાથી પિતનું વિરેચન થતાં તેમજ મૂત્રલ ગુણથી  
ઉપયોગી થાય છે.

૧૧. હરસ : અર્થ-હરસ-મસા (પાઈલસ)ના બધા  
પ્રકારમાં શિવામણુ પરિણામદાયી છે. કારણ કે શિવામણુ  
હરસનાં કારણોને દૂર કરે છે. તે પાચન, દીપન, અનુલોભન,  
વાતદન, કિદન, ક્ષારીય, શોધન, લેદન વગેરે ગુણોથી તેમાં  
સહીયક બને છે.

આગળ શિવામણુના ગુણકમ્ભમાં મૂત્રના સામાન્ય ગુણ-  
માંથી લીધેલા ચાર કમ્ભ ખાસ મહત્વના છે જેની વિગત  
આ પ્રમાણે છે.

૧૨. લેદન : ધનવન્તરિ નિધિદુમાં મૂત્રનો સામાન્ય ગુણ  
લેદન છે, જે શિવામણુમાં પણ ગણ્યાવી રાકાય. લેદન એટલે  
મળનું લેદન કરનાર. મળનો અર્થ પુરીષ પણ થાય અને  
શારીરિક અન્ય મળો પણ થઈ શકે. જૂની કબજિયાત કે  
દૂષિત થઈને ચોટેલા દોષો-દૂષ્યોનું પણ શિવામણુ લેદન  
કરી શકે છે.

૧૩. વાતાનુલોભન : વાયુનું અનુલોભન કરવાનો ગુણ  
મહત્વનો ગણ્યાય. કારણ કે આખા શરીરમાં અનુલોભન  
(સુવંધો) વાયુ જ આરોગ્યપ્રદ છે. તેનાથી જિલ્લાએ પ્રતિ-  
લોમ (અવંધો) વાયુ રોગકર, દુઃખકર અને શુણકર છે.  
દરેક જાતના શૂણ, આનાહ, ગુલમ, હરસ વગેરે રોગો  
આ ગુણથી મટાડવા સરળ બને છે.

૩. શોધન : ધન્વન્તરિ નિધંડુ અને સુશ્રુતમાં મૂત્રનો સામાન્ય ગુણ શોધન હોવાથી શિવામણુના શોધન ગુણનો અથ્ મળશુદ્ધિકર તો થાય જ, તે ઉપરાંત વાત-પિતા-કંઈ દોષોની અશુદ્ધિ તેમજ ત્વચા, રક્ત, શુક્ત વગેરે ધાતુની અશુદ્ધિ દૂર કરે છે. પંચકર્મની જેમ શિવામણુસેવન દેષશુદ્ધિ કરી આરોગ્ય જણવી રાખે છે અને હઠિલા રોગ દૂર કરે છે. તે શિરાવિરેચન પણ છે.

૪. હૃદય : હૃદય એટલે હૃદયને હિતકારી અથવા હૃદયને પ્રિય. ધન્વન્તરિ નિધંડુ અને કૈયહેવ નિધંડુમાં મૂત્રનો સામાન્ય ગુણ હૃદય કણ્ઠો હોવાથી શિવામણુ પણ હૃદય છે. શિવામણુ રસાયન, બદ્ધ, અનુલોમન વગેરે ગુણથી હૃદય છે.

૫. સ્લોતોવિશોધન : શરીરના અનેક સ્લોતોમાં અશુદ્ધિ આવવાથી મોટા ભાગના રોગો થતા હોય છે. તે શુદ્ધ થતાં આરોગ્ય પ્રાપ્ત થાય છે. શિવામણુ પિતાકર, ખાડું ક્ષારીય, તીખું, કડવું, ઉણું તીક્ષ્ણું, શિરાવિરેચન, અનુલોમન, શોધન, લેણ, કટુવિપાકી, રેચક, આમૃપાચક, પાચન, શોથન વગેરે ગુણથી સૂક્ષ્મ સ્લોતોને સાક્ષ કરે છે.

\*

## ૦ શિવામણુ...ઓષ્ઠદ્યોજના રૂપે—

આયુર્વેદના અનેક અન્યોમાં ગોમૂત્ર, બકરીનું મૂત્ર વગેરેનો તો ઓષ્ઠદ્યો બનાવવામાં ચ્યાપક ઉપયોગ કરવામાં

આવેલો છે. ઉપરાંત માનવમૂત્રનો પણ કચાંક કચાંક ઉપયોગ થયો છે.

—શાર્ગધર સંહિતામાં :

નરમૂત્રે તુ જોમૂત્રે સપ્તાહું રસકં ક્ષિપેતુ।

હોલાયંત્રેણુ શુદ્ધિઃ સ્થાત તતઃ કાર્યેષુ યોજયેતુ॥

ખાપરિયા(રસક)ને હોલાયંત્રમાં શિવામ્ણુ યા જોમૂત્રમાં નાખી સાત દિવસ તપાવવાથી તે શુદ્ધ થઈ જય છે. આ રીતે શુદ્ધ થયેલું ખાપરિયું બધાં કાર્ય (ઔષધો અનાવવા) માટે યોજવું.

—યોગરત્નાકરમાં :

આ ભાન્ય અત્યન્તના રસ પ્રકરણમાં લઘુ ભાલિની (માલતી) વસ્તના એ પાડમાં પણ શિવામ્ણુનો આ પ્રમાણે ઉપયોગ થયો છે.

(૧) પાઠ ધીલે

નરામણુમદ્યે રસકસ્ય ચૂણું

દિનાનિ સપ્ત ત્રિગુણાનિ પૂર્વન्।

ધૂત્વાત્પે શોષિતમેતહેવ

નૃવારિ લખું ભવતીતિ થાવત्॥

ખાપરિયાના ચૂણુંને માનવમૂત્રમાં ૨૧ દિવસ સુધી સૂર્યના તાપમાં સૂકાઈ જય ત્યાં સુધી રાખવું.

(૨) પાઠ ત્રીલે

ખર્ફર માનુષે મૂત્રે સ્થિત વસ્ત્રત્રિસૌતકમ्।

શુદ્ધ ખાપરિયાને માનવમૂત્રમાં ત્રણું સપ્તાહ સુધી રૂબાડી રાખીને ખરક કરવું.

હીરાની ભસ્મ બનાવવા માટે તેને માનવમૂત્રની ૧૦૦ ભાવના આપવામાં આવે છે. અનેક રોગને મટાડનાર આ હીરક ભસ્મ કેન્સરનું અથ્રતમ ઔષધ મનાયેલ છે.

\*

### ૦ શિવામ્યુ...ચિકિત્સાકર્મિયે—

આયુર્વેદ રોગો મટાડવા માટે ઔષધયોજના, પદ્ધતિપાલન વગેરેની સાથે આવસ્થકતા હોય ત્યાં ૫ંચિકમ્ ઉપરાંત બીજુ કેટલીક કિયા કરવાનું પણ કહેલ છે.

અણાંગ સંચહ, કૈયદેવ નિધિંદુ (૧૬૦૪-૪૨૭) સોઢલ નિધિંદુ (૧૬૦૪-૮૮૨) વગેરેમાં શામન અને શોધન કિયા રહે ચોનેલ છે, તેના રસાયન કર્મની વાત તો આપણે આગળ કહી ગયા.

કષેત્રિપતમધીમાગ્નું યુક્તાં સેકેપનાહુયો ।

વિરેકાસ્થાપન સ્વેહ લેપોદ્વત્તન કર્મસુ ॥૪૨॥

—કૈયદેવ નિધિંદુ

શિવામ્યુ પિતનું અધોમાગ્નથી (મળમાગ્નથી) વિરેચન કરે છે. ઉપરાંત તે સેક (રેડવું-સિંચન કરવું), ઉપનાહ (પોટિસ), વિરેચન (મળ-મૂત્રનું વિરેચન અને શિરા-વિરેચન), આસ્થાપન (બસ્તિ), સ્વેહન (શેક આપવો), પ્રલેપન તથા ઉદ્વત્તન (શરીરે ચૂણું સાથે ચોળવું) વગેરે કર્માં ઉપયોગી થાય છે.

शिवार्थ्युसेवन

७८

नीयेनां सूत्रोभां पृष्ठ लगभग ३५२ प्रभाष्ये ०४  
कहेवानुं छे.

विरेकास्थापनालेप स्त्रेहाद्धि तु कर्मसु ॥८८२  
—सोहल निधंदु

विरेकास्थापनालेप स्त्रेहाद्धि च पूजितम् ।  
—अष्टांग संग्रह



# આયુર્વેદમાં શિવાભૂ-ગુણું સારાંશ

૦ સ્ક્રંધુ : કદુક સ્ક્રંધુ (તીણો વર્ગ) ... ચરક.

શિરાવિચન (માથાનો કંક કાઢનાર દ્વારા)

... સુશુપ્તિ.

૦ રસ : ખારું, કડું, તીખું, થોડું મધુર.

૦ ગુણું : ઉણુ, તીક્ષણુ, લઘુ, ઇક્ષ.

૦ વીર્ય : ઉણુ.

૦ વિપાક : કદુ (પચે ત્વારે તીખું), (મધુર પણ હોઈ શકે).

૦ હોષ્ટનતા : કંદવાતનાશક.

-પિતવધક.

-પિતવિરેચક, પિતસશોધક, પિતશામક,

-ત્રિહોષશામક હોવાની શકુચતા.

૦ કર્મ : -રેચક, વિરેચક, પિતવિરેચક

-આમપાચક, આમનાશક

-પાચન

-ધીપન

-શાધન

-ભેદન

-વાતાનુલોભન

-સ્નોતોવિશાધન

-રસાયન

-ઘૃદ્ય

-રૂચિકર

-હૃદ

-ક્ષારીય

० वैगीचनताः - कक्षजन्य रोगोः

- वातजन्य रोगोः

- आमजन्य रोगोः

- चूर्म रोगोः

(सविशेष रक्तपात्रा)

- नेत्ररोगोः

- उदृक्तरोगोः

- अरुचि

- आनाह

- कुमि

- गुदम्

- पांडु

- सूतभाधा (अतर्त्वालिनिवेष)

- मेद (यरुभी वधवी)

- मेह (भूचर्णी)

- रक्तहोष

- रक्तपित

- व्रण (धा)

- वृद्धम् (वराध)

- विष

- श्वित्र (धोणो और)

- शूण

- सोन्तु

- हरस

